

થા. બાણી છી. વાતઅં. શામજનાંરા. શાહેબો. તેહેકીઝ.

કરી. લખી. ગીમાંછે. તે. શાર્દેલી. વાત. મજાતી છે. અં
ને. તમાંમ. પછાતની. લુલેની. કીતાયારં. દીમજ દે જર
દનાં. જલ્દુંશા. બાબે. લખી. ગીમાંથ. જે. રોજ. (૧) રેહે
ઓ. આહા. (૧) રેહેલો. ઝૂરપર હીનને. દીને. દીમજ દે જર
દ. તખને. એડો. તે. દાહુડે. કાબી શાનાં. હોઓરનાં. (૧૪૪૦).

ચર્ચિદશો. ચાલીશા. વડશામાંથી. (૮૫૦) નવશો. શાદ.

વરશા. ગુંજરેસાં. હુતાં. પછે. જેવારે. (૧૧૭૬) મંગીમાં
રશો. અંગૂઝે. (૮૬૦) નવશો. શાદ. ઉપર. વધારી ઉ. તે
વારે. (૨૧૫૬) ઉલ્લવિશાશો. ઉચંગું. થાઉથ. ઝાંબે. કાબી
શાનો. હોઓર. જે. (૧૪૪૦) અંદશો. ચાલીશા. વડશાનો
છે. તેહેને. દિમાંથી. કાડીદે. તેથારે. બાફી. (૭૧૬) શા

તશો. શોલ. રેહેછે. વલી. બીજ. રવેશો. ગરૂરીએકે. ન
 વશો. શાલને. કબીશાલાનો. હોઅોરમાંથી. કાકીએતો. (૪૯)
 એઆરશો. હેઠી. બાકી. રેહેછે. તેહેને. (૧૧૮૬) અગ્રિઆ
 રશો. જાણુમાંથી. કાકીએતો. (૭૧૬) શાતશો. શોલબા
 ટી. રેહેછે. દુવે. દિ. અંગલા. અમલ. રસમાંસો. શાહી. અલે
 ચ * હવે. જેહેથારે. (૭૧૬) શાતશો. શોલને. (૧૨૦)
 ઉછશો. વીજા. લાગે. નાખીએ. તેવાદે. (૫) ચાચ. નીક
 લેઆ. બાકી. (૧૧૬) ઉછશો. શોલ. રહેખા. રછે. માલુ
 મ. થાટું જે. અખરી. નદા. હોઅોરમાંથી. કબીશા. (૫)
 ચાચ. ઝૂરા. ગૃહેઆ. અંનો. છેલા. કબીશાની. જોખ
 ત. અનરસાદ. અહુનામા. અખી. અંનો. (૫) દુદા. ક
 ઘિશાનું. અંદ. (૮૧૬) ઉછશો. શોલમું. રસમાંસું

કુણે. છિહ્નેની. લાદુશીલ. ઉમણે જે. દોખોરને. કાડી. ના.
 અતં. (૭૧૬) શાતશો. શોલ. બાકી. રેહેય. તેહુને. જે
 વારે. (૧૨૦) ઉદ્ધારો. વીશા. ભાગે. વેચીઓ. તેપારે. નીક
 જે. (૫) પાંચજે. તે. કૃવલદીન. તથા. અરદીએહેશાત.
 તથા. ખોરદાદ. તથા. તીર. તથા. અમૃતદાદ. માંદુણે.
 દીખાને. જે. અદાખી. દીએજ હુલુદાનાં. જમાંનાંથી. ક
 બીશો. કરતા. આવતેતો. હુલ. ક્રમાગાલો. દોખોર. ત
 માંમ. થાએઓ. હુલે. ક્રમને. નવા. દોખોરમાંથી. (૭૧૭)
 શાતશો. શોલ. વરશા. આકૃતાખી. નાંકૈશા. ગૂજરેસા.
 હોલે. તે. હિ. રીતેકે. (૧૨૦) ઉદ્ધારો. વીશામે. વરશો. નવા.
 દોખોરમાં. કબીશો. થાએઓ. હોલે. અંને. અંગશોનાં.
 દન. કૃવલદીન. નકુનાં. શાચે. લાગું. હુલે * પલી.

(૩૪૦) વૃશો. ચેણાલીશામે. વરશો. કુભીશો. આઉંઓ.
 હુતે. અંને. અંમશોના. દાહુડા. અરદીએકેશાલ. અહીં
 ના. કાથે. ભલલે. વલી. (૩૫૦) તરફાશો. રાખમે. વરશો.
 કુભીશો. આઉંઓ. હુતે. અંને. અંમશોના. દાહુડા. ઓર
 દાદ. મહીનાંની. પજધાડે. આવતે. વસી. (૪૦) ચેપાર
 શો. હેઠીને. વરશો. કુભીશો. આઉંઓ. હુતે. અંને. અંમ
 શોના. દાહુડા. તીર. મહીનાંની. પાછલ. લઆતે. વલી.
 (૪૦૨) છાંશોમે. વરશો. કુભીશો. આતે. અંને. અંમ
 શોના. દાહુડા. અમરદાદ. મહીનાંની. પાછલ. રેહેતે.
 અંને. તે. દાહુડે. રોમધાર. અંને. (૪૦૩) ઉષશો. અંદર
 મું. વરશો. આરૂનાબી. મુરાં. અંને. અંગ્રેઝ. દાહુડા.
 આઉલા. હુતે. કે. અંમશોના. દાહુડા. અમરદાદ. મહી

નાં. શાખે. શાખેન. સથા. બરકરાર. હલે. હલેનેવા

રે. (૫) ચાચુ. બરકા. (૮૬) છાયું. દાહાડા. ખૂંઝુ. ચાદુ

તાબી. નમાન. ચૂંજરે. તેવારે. છઠો. કબીશો. ચુંરો. ચાદ

ય. ક્રુણે. કબીશાની. જોખન. શાહરેલર. અહીનાન્મા. ચા

વેચ. કાંદલ. ઉ. (૧૨૦) ઈંશો. વીશાભૂ. બરકા. છેને.

(૭૨૧) શાતશો. વીશાભૂ. બરકા છે. વાણાતે. ગાટેચું. ને.

બરકા. માણા. (૧૩) તેરખું. ગાળો. ક્રુણે. (૨) બેદ. શાહરે

બરક. અહીના. અશાલ. તથા. ઝુરે. ઝરે. ક્રુણે. અંમશોને. ઝ

રે. માણાની. શાખે. અલગાવે. હલે. વીચાર. કરી. ગરેથો*

વીજા. મુંખતેણાર. રીત. ઉછેને. લે. પદાપી. (૧૧૮૬)

અંગરીચારશો. છાયું. બરકાને. ઉછ. શોઅરો. વીશાને. લા

ગે. વેચીઓલો. રહેઅરા. (૮) લાય. ક્રુણે. બાદી. રહેઅરા.

(૧૧૬) ઉકશો. શોલ. ઇથી. માંદુભ. આહિ અને. ઈડ્વિલ્ડેજર્ડ
નો. વિકલચી. (૧૭) પાંડા. દાહાડાણી. કશારને. જેતા. ચાચતે.
ને. કલ્પિશા. પ્રરતેતો. ઈપાજનો. વિકલ. શ્રુદ્ધી. હાલ. કલ્પિશા
(૧૮) નવ. પ્રેરણ. ગ્રૂપરેટા. હતે. ડિન્ઝે. દશમો. કલ્પિશા. નાંને
૧૦. ઈડ્વાને. ડિન્ધે. ૨૧. લેન્દૂ. ડિ. એ. એ. ચરણ. (૧૧૯) હકશોને. શો.
લશ્ન. લશ્નું. હોતે. પછે. પેલા. (૧૯) નવ. કલ્પિશા. માંથી. (૨૦)
એડ્વાર. કલ્પિશા. નાં. એડ્વા. (૨૧) એડ્વાર. ડિ. એડ્વાર. તથા. હેડ.
સથા. બેહમણ. સથા. ડિશા. પ્રેન્ડાન્ડ. ઈ. હોડ્રોર. પ્રેરો. આંગ્રે
ઝો*. ડિન્ઝે. પેલા. કલ્પિશા. માંથી. કલ્પિશા. (૨૨) પાંચ. આડી.
રહે. ડા. ને. અન્ધે. ડા. ગા. લ. બ્યાન્ડાન. અરેઓ. માં. ડા. ને. કે. છ.
એ. તે. હુદી. ધા. ત. ક્રીધા. ધો. ઈ. એ. જ. હે. ર. આ. એ. અ. લે. બ્યા. ઉ. - પા. ત.
શ્નુ. ઈડ્વાલ્ડેજર્ડની. ડિગાડુંની. ડિન્ઝે. ને. ઈડ્વિલ્ડેજર્ડની

પાછલની· ખરીછે· અને· શારવેની· વાત· મલતી· આવેચ· હુ-
 રીતેએ· શારવે· લોકો એહેલે કે· હિ· ક્રોરવી· તારીખ ના· શારૂદ્યા
 તથી· તે· ઈડ્યુકેશના· વખત· સગી· (૧) પાંચા· દાદુંડા·
 ની· કશાર· લેતા· અને (૧૨૦) દિક્કાશો· વીશા· વરશો· કબીદો·
 કરીને· દિક્કા· ભાશા· વધારતા· અને· વલી· ખૂલ· વાનાવ· લોકો·
 એહેલે કે· ઈડ્યુકેશના· ૫જી· (૧) પાંચા· દાદુંડાની· કશાર·
 જીધી· નખી· અને· તદ્દન· ખૂકી· બેઠા· અને· તારીખને· બે· કરા
 ૨· ગંધી· હિ· બેઉંવાત· ઈચ્ચાને· અગ્રાઉ· કશાર· લેતા· હતા·
 અને· પાછથ· નંહી· લીધી· હિ· બેઉં· વાત· મલતી· આવેચ· હુવે
 કોઈ· હિન્દુ· નંહી· શામ જેણે· કબીદો· ઈડ્યુકેશનાં· વખત
 તથી· ધૂદી· ગીઝો· કરી· એહીગી ચ્યાચ· તેથી· કબીશાની· વાત·
 ઓરી· હશે· છાંડિને· તેહેકીકાતની· કુંઠ· માલૂમ· ચાઈંગે·

એ. દેલા. (૧) ઉખ. મહીનો. કબીરાનો. આવતો. તેવા ૨. ૫
 છે. (૧૧૭) ઉખશો. અંગુણીશા. વરશા. લગી. શંધલા. વર
 શોને. (૩૯૫) તરંગાશો. ઓ. પાંશા. શાહુડાના. લેતા. તે
 (૧૨૦) ઉખશો. ઓ. ચીશામા. વરશા. લગી. લેતા. ૫ છે. (૧)
 પામા. શાહુડાની. કશાર્થી. (૧) ઉખ. માશા. વધતો. લેવા
 રે. બીજા. કબીરાની. જોયત. પોડોચલી. રૂપને. માંલું. અથા
 હ. ચૂકુલે. હૃદાને જરૂર. શોહેરી. ચારસું. જલુંશી. વરશા.
 તેતે વરશા. કબીરાનું. છે. હૃદાને. હૃદાને જરૂર. જરૂર. તારી
 ખને. કબીરાની. લારીખ. જાંણાદી. કાંચિલે. તેવરશાના.
 કબીરાની. જોયત. આવા. મહીનામા. ચાચી. હતી. તેવા
 ૨. ૫ છી. શંધલા. વરશા. (૩૯૫) તરંગાશો. ઓ. પાંશો.
 શાહુડાના. ગંધુતુ. માવેચા. જો. પારશી. લો. છો. ની.

પાદશાહી. ડાયર. નંદી. થાઈ. કુતે. ડાનો. હિન્દુજ દેજુદી.
 જલ્દુંશી. તારીખને. (૧૨૦) હિન્દુશો. વાણી. વરણ. પાદશાહ.
 કુતેની. કલ્યાણી. નોભત. ચાદર. મહીનાંમાં. આપને. અ
 ને. (૧) પાદશાહી. દાહાડાની. કશારને. લેને. એઠા. પારણી. લો
 ઓની. પાદશાહી. કેમણે. તવારીખની. કૃતાઓઓ. લખેલં
 છેને. હિન્દુજ દેજુદની. પાદશાહીને. (૨૦) વીણી. વરણ. ગુ
 રુદ્રા. એઠી. ડાયર. થાઈ. ડાનો. બીજ. કલ્યાણી. નોભ
 ત. લગી. પાદશાહી. નંદી. રહી. તેથી. કલ્યાણીની. ચાલ. બી
 લ. ઝૂલ. મોકૂદુ. થાઈ. ડાનો. અરીવાત. હિન્દુજ દેજુ
 દનાં. જલ્દુંશા. એઠી. (૧) પાદશાહાડાની. કશાર. હૈશાખ
 માં. આપી. નથી. બીજુ. મેહેનુભાં. ચાંગલ. લખેલુંછે.
 ડાનો. પુંછીઉંઘને. પારણી. લોખોની. તારીખ. હિન્દુજે.

યાં (૨) એવે લાગીએ છે. કિનો અધ્યાત્મિક હિન્દુઓ હોય

રૂધી-બેહિ-તારીખ-કેહેછે-તેહેની-પાત-શાક-તથા-બેહેમ-લખા-
 અંકા-વીચાર-ચ્યાને-હીયાંનગી-જરેલી-નંગાવી-કાંઈલે-એ
 આં ઈ-ઉપાગાલી-તથા-હૃદાંની-કેતરા બોમાં-ફાનાંધ-લોકો-
 લખી-ગીર્યાચ-લેચી-૧૧) ઉછ-તારીખ-શોદા વિભીજ-તારી
 ખ-લખર-ચ્યાપતીએ-નંથી-ચ્યાને-ખોઈ-શાખશો-ઉંડ-કાંઈ
 શાની-તારીખ-વગારે-ઘીજ-તારીખદ્વારાંન-કુદ્દુંદ
 નથી-ચ્યાને-શાકુ-ઉંઘાદુ-ઉંસાં-લોકોના-શોલથી-તથા-
 ઉપાગસી-કેલાઓચી-માલુમ-આદિયલે-આરણી-લોકોની-
 ઉછું-તારીખછે-ચ્યાને-કુભીશો-કરવાનો-કાંઈ-ઘીનો-
 શાખખ-નંહી-હુતો-મગાર-ઉંડછુ-ઉખાદતમાં-અંસલ-
 નંહી-પડે-ઘીનું-હુમોઝો-ચ્યેમ-શાંલલેઉં ચ-લે-

[૭]

ઉદ્ધ. શાખશા. નાનુંમંતથા. હૃદિતલો. અંગાનાર. બ્રલાંકે. ૫

પોતાના. ગુમાનનમા. પરેતાને. મોહોદો. ડાલીમા. જાંગો. ૫

અને. માદારા. પારેઅભો. પારશીદ્વોના. લદી કાચી. નથા

શ્રદ્ધીશાખી. વાંકેડ્રે. હુશે. તે. શાખશા. ઉમ. જેહે છે. પાર

શી. લોકોલી. લારીઅ. શાસુદ્વાલથીજી. બેદ્વશાર. અની. પ

ગાર. શબ્દીશાખી. હુલી. અને. જીલે. ઉલભાલિને. પોતાની.

દસીસ. પૂરી. રાખીએ. ઉભાન. મહની. શાંખલનાંશાર. મા

લુમ. થાઈ જીલે. ઉ. અણું. તેહિયારતને. શારીપણી. શામળે

ઓળલંધી. પુંદ્રાને. તે. હિયારત. શાંખલામોજે. કુણીગી

[૮] ઉ. લગોહિ. ઉદ્ધ. શાખશા. કરી. જાખેચોડે. તે. શૂરીગીર. પારશી
દોનો. શૂદરગ. અને. તેહેના. વાખતમા. કુણ. શૂરીગીર. લોછીમા. એ. એઢો.
મુદા. ઝીરોગ. અણ. મુલા. કાંદેશને. કાંદેશી. હે. જો. ખંડુંદો. રો. રાણી. ત
થા. પોતીશા. મુદા. શૂરીગારોની. નરકૈયો. જાખ્યનાંશારી. કાંદેશી. કાંદેશો. ને
લરધો. શાલી. દીજામો. જાંદીશે. તે. દી. હાંમું. અદ્વો. છીદુંદો. કાંદેશાને
જરથો. શાલી. દીનામાંદી. મુંગાંકેર. નાંકારી. નેને. દામનથો. ન

શાચ· તેહેને· તથા· જમાન· જીલે· તથા· હૃતિની· કીલાબો·
 શાથે· મલનીજાછે· કે· પરદશી· લોકોની· નારીખ· શાસુંશાત·
 થીતે· ધીરજદેજરદના· જમાના· ઝૂભી· કશાર· તથા· કાંઈ
 શાની· ચાલી· ચાલી· જીવો· ધીરજદેજરદ· પણી· જેવારે·
 એ· નારીખ· ધીરજદેજરદી· કે હેઠાઈ· ને હેયાર· પણી·
 વગાર· કશારે· તથા· વગાર· કાંઈરાએ· ચાલી· વારા
 ને· મહને· ગાડેચાને· જીલે· દિલખાનીની· દિવારને· ફું
 બફું· આએ· જગા· ઉપર· બએ જીના· કરુંછે· શારવે·
 વાંચનારા· શાહેબોને· માંલુભ· ધાએ· કે· દિ· શાખ
 શાને· પારદશી· લોકોનાં· તરીકાની· કશી· અખર· ન
 થી· જીવારન· દિલખાનીની· જીવારને· શાખજાનોજ·
 નથી· જીવારન· દિલખાનીની· જીમજોજે· કુરીલ·

[૭]

(૩) તીજો — પારશ્રી લોકોની તારીખ કૃતી તથા
 કબીરાથી આલી છે. ઉ. ૧૨૯૧ (૩૫૫) તરં હાથો ઓ.
 પાંશાઠ દાહુડાન્દુ છે. ઉલાં મહીનાં (૩૦) તી શા દાહુડાનાં
 અને દંન (૫) પાંચ વધોરાનાં અને મહીનાં જી. પા
 ઊંલ વધોરેચ અને જણું ભી. લોકો કૃતી તારીખ કૃતી
 માં ઈચ્છાને અનાખનાં મહીનાં જી. પાંચ લ. વધોરેચ
 અને પદીખથી અખત ન રાખ ની. તારીખ ઉપરાંતો
 હતી. અને ઉ. તારીખ નાં વરસા તથા મહીનાં કૃતી
 કબીરાથી આલી છે. માટે જણું ભી. લોકો. ગાંગો. ઘરી.

[૮] ઉ. જાગો. પારશ્રી. લોકોની. તારીખ. કરી. કૃતી છે. તેથી. ઓરાદ.
 હૃદયજીવની. તારીખ. શામલ પી. કરી. ઉ. જીને. ઉલાં જી. ઉ
 પારશ્રી. પાલો. એ પાડેથી. શાકુ. કખે અને. એ. તારીખ જુ. શાકુ
 અને. હૃદયજીવની. પી. ન. શી. હૃદી. પારશ્રી. જી. પારશ્રી. લોકો. નો.
 તેલસો. પાંશાઠ. હતી. તેથી છે *

કંસનોં લાચેચ્યાં ડ્રિનોં ઉં તારીખ નું શાર્કુઅાતાં ઈંગેજેજ
 એથીન-શેહેરીઅપારાં તખતે બેઠો-લે-દાહુડેથી છે- ડ્રિનોં ઉં
 પારશીં લોકોનોં છે લલો-પાદશીં હું હતો- ડ્રિનોં ઉં પરશ
 નો-પેહેલો-દાહાડો-મંગાલવારાં છે- બંગાલું જે- જીજે- ઉભાં
 નીલો-અંગ-મુંદો-થાંડો* હું- ડ્રાગાલી- વાતોની- તેહે
 કીએ- અરણારાં- લોભોને- માંલું- થાંડો- ઉં- જીજે- ઉભાં
 ની- વાલો- ફૂરમાં- બેચ ને- (૫). પાંચ- દાહાડા- વાખારાનાંને.
 આથાં- મહીનાંની- પાછલ- લેતા- હતા- હિંબાતથી- શારીખાં
 મ- દલીલ- માંલું- રડેચલે- પારશી- લોકો- ઉં- તારીખનોં
 શાર્કુઅાતથી- ઈંગાને- બંગાલોં- પાદશાહાનાં- વાઝનથી-
 (૧૦)- પાદશા- દાહાડાની- કશારને- હેઠળખમાં- લેતા- હતા-
 ડ્રિનોં- કષીશો- કશતા- હતા- ડ્રિનો- (૧૨૦) ઉંશો- વીશી-

વરણો. દિક્ષ. માદ્રા. પદ્માશીલો. પદ્મારાણા. (૫) રાંય. દાહુડા.
 તેહેની. પાણીલ. પદ્મારતા. ડાનો. જેવારે. (૧૪૪૦) રાણી.
 શોખો. ચાલી રા. વરણો. ગુજરતા. તે. વેલા. નાંદો. હોદ્દોર.
 ઘાતો. ઉમ. કરતા. જેવારે. કબીરાની. નોભુત. રાંયા. મ
 કુનાંભા. ક્ષાલી. ડાનો. પદ્મારાણા. દંન. (૫) રાંય. રાંધા.
 અહીનાની. પાણીલ. રહીગીએા. ડાનો. ઈંગરદેનુદુની.
 પાદશાહી. પદ્મી. કાખીશો. મોદુઝુ. પાદશો. વાશાતે. દિ.
 ધર્મા. ક્રીમાંચેથલે. કૃપા. ઈંગરદેનુદુ. પછે. જેવારે.
 પાદશીઓની. પાદશાહી. ગેદુ. તેચાર. પછે. ક્રીદાદુ.
 લોકો. પદ્મારાણા. દંન. (૫) રાંય. રાંયા. અહીનાની. પા
 ણીલ. પદ્મારેચ. ડાનો. મુંશાલમાન. લોકો. કેહેણેલે. દ.
 ચાલ. પાદશી. લોકોએં. હુતીશે. જેવેલા. કુખીશો. કર

(૭૩)

તાંહતાં તેવેલાં અભીશાળાં મહીનાંની પાછલાં વધારતાં
ઝ્યનો દીક્ષાજ્ઞ હેજરદાં પછે જેવારે અભીશરો મોદ્દુદ્ડું થાંપે
થ્યો માંદે ડિક્ષાપંચદાં મહીનાંની પાછલાં વધારેદ્માં જેઠ
એ * રુદ્રે કું ક્રેદું છે કું બે દુઃ ગુણે હિલખાંની પાલાએ પા.
રશી તારીખું જી કંભશૈદનું જમાંનાંચી શાકું થાઈ તેમાં
તથા દીક્ષાજ્ઞ હેજરદાંથીથાઈ તેમાં ઝ્યરદાં જરી જ્યંદી પાડી ન
ધી પાશાને પીયારો ઝ્યનો જેવાં જરો પરો પીયારો જરો કે દુકૃતાસા.
શામાં લોકો ઉપર ઝ્યજ્ઞલો અર્દમાં જરનાર છે *

(ઉશાહેબની મોહોર જાણની છે) વંદો ઘોશાનો ઝ્યો જોહ
પારા મહુમદ શાહેઝ અલ્લાહો હોશેની (ઉશાહુદત જાલી જ
નાંખું જમાંનાંલો ઉંદો મીર મહુમદ શાહેઝ મુનેજજનમાં દીશા
કુંનીની છે *)

(શાખણી ૧ લી*)

ઓદાતાલાન્દું નામં શાર્ડેની નોમં કરતાં ની ને હું છે *
 ને હેકીએની રાહે કૃષ્ણાની લારીઅમાં મુખીશાની ચાલ જે
 છે ને હેમાં કશી શાસ્ત્ર તથા શોભે હું નથી ડાને ઈંડ્યુલ્યુન
 રદ્ધીનાં શોહેરી આરનાં જર્માનાંથી ઉં મુખીશાની ચાલ ન્યુ
 વી તેથી ઉભનું હું શામજાનું જે હ્યાગલા જર્માનાંનાં ઉં ચાલ
 નું હું હતી ડાને જે શાખણાં બોલે છે જે (૨) બોઝે તારીખ
 હતી તે હેલી ચાત ઘરી ઓરી તથા બેઝ છે હ્યે એભીનાં
 તરેશીલાંચાર કુંઠ શામજાનાં નારોતો જે રીતે ડ્રાઇ મેહેજ
 રની મોરો નન્દું મી જર્માનાંની બ્યલલીનું શા એજરીનું પ
 ખતનો ઉનો મીર મહમુદ શા હેઠ તથા કુલેલ આલી મ
 કાનેલ જર્માનાંનો ઉનો મીરજાં ડાયદ અલાહ ઉં કંદું

(૨) બેણ-મલીને-ખરિયાંન-ક્રીદુછે-સે-પરમાણોછે-અને
તે-શાખલી-ખીનાં-માહારા-ખેડિયામાં-ચાવીછે-અને-હું-
પાદશાહની-મોહી-દીલતની-દોવાગી-છે * (દિ. શાહેબની
મોહોર-ખદાંમરોકીછે) બંદો-મહભદ-હૃદાન-હિબજે-મહ
ભદ-હોશેન-અયલ-હૃદાની-અયલ-હોશેની- (દિ. શાહુદી-
અઓલમાંચોની-પાદશાહની છો-ક્રી-હુમેશો-રાખે-ઓદાનાલા-
કિહેનાં-ઘૂલંદ-શાહિયાને *)

(શાખારી- ૨ અ *)

તેછે-ઓદાનાલા * તેહકીઝ-ધાજેહ-તથા-રોશાનછેને-લેકું
ક-ઉંષેલાભમાં-લખેલ્દુછે-કુરશી-તારીખ-બાબે-તથા-હિજ
જ-તારીખછે-લેબાબે-તથા-કબીરાની-કેવુંદ્યત-ને-લખી

(૭૬)

ચેતેનાં કશોં શકું શોં બેહું નથીં ઉપનેં ઉં વાતનેં લખનાં
 રક્ષણેલોં કાં મેલોં મોરાં નજ્દું નીં મશાહુરું રું મીરાં મહમેદ
 શાહેસુતથાં જનાં નાં નાં દિખોં મીરાંનાં અશાહ અખાહ નજ્દું
 આજેં હું બેશોં રાખેં એં દાતાલાં તેનાં નીં વૃજલગ્નીને * હું
 શાહીનોં કરનાં રું દોવાળોં શોખ ઉપખૂલાં કારાં ભાડાં કાળ *

(શાખશીં ઉ ૪ *)

શકુંકરું યાં જૂલાં એં દાતાલાનાં નાં મથી * ક્રારથીં તારીખ
 આદુલીશોં કે છે તેં તથાં ધારથીં તો કોની * પ્રદશાદી કીર્તાં
 પંજ્યુંનીદ્વોં ઉં વાત મશાહુરું રું તથાં કિંદાડીછે * ઉપનેં તેં
 વાતનેં મોહોરાં નજ્દું નીં લો ક્રોં નહેર કરી ગીરીદાય * તો કોઈ
 નીતાભાતાનથી જે તેને દીનજાર પ્રશીં શાખે ઉપનેં ઉં કખીશાં

ਜੀ· ਤਾਰੀਖ· ਰੋਜ਼ਾਹਿ· ਕੋਈ· ਬੀਅਂ· ਤਾਰੀਖ· ਵੱਗ ੨· ਅਸਾਡ· ਕੁਝੀ
 ਰਾਨੀ· ਕੋਈ· ਭੇਜਾ ਅਮਾਂ· ਨਥੀ· ਤਥਾ· ਉਦ੍ਘਾਨਾਂ· ਬਾਂਧਾ ਜਾਂਚਾ· ਕੋਈ
 ਨਾਨੂੰਗੀ· ਲੋਕੋਨਾਂ· ਪੁਲਾਂ ਅਮਾਂ· ਤੇ ਹੋਣੀ· ਕਥੀ· ਅਪਸਾਡ· ਨਜ਼ਦ· ਆ
 ਵਤੀ· ਨਥੀ· ਅਪਨੀ· ਯੋਝ ਸਾਂ· ਨਜ਼ਦ ਮੌਕਾ ਪੇਚ· ਜੇ· ਕੋ· ਅਫਾਖੀ·
 ਉਲੋਕੋਮਾਂ· ਬੀਅਂ· ਤਾਰੀਖ· ਹੁਤੇ ਹੀ· ਅੱਖ ਅਭਤੇ· ਤੇ· ਤਾਰੀਖ ਨੂੰ·
 ਅਹਿਆਂਨ· ਅੱਗ ਤੇ· ਤਥਾ· ਨਾਨੂੰਮਨੀ· ਭੇਜਾ ਅਮਾਂ· ਉਧਾਤਨੀ· ਅ
 ਜ਼ਖੂੰ· ਅਧਾਰ ਤੇ· ਅਪਨੇ· ਤੇ· ਤਾਰੀਖ· ਅਸਾਂਕੂੰ· ਹੁਤੇ· ਖਾਣਾ· ਤੇ ਹੋਣੀ· ਕ
 ਥੀ· ਅਸਾਂਕ· ਨਥੀ· ਧਾਰਾਤੇ· ਯੋਝ ਸਾਂ· ਅਛਿਛਿਲੇ· ਤੇ· ਧਾਰ· ਕੱਡੀ·
 ਛੇਡਨਾਂਹੀ· ਹੁਥੇ· ਲਕੜੀ ਲਖਾਰ· ਜੇ· ਪੁੰਜਾਂਹੀ· ਇਹਿ ਤੇ ਛੇਡੇ· ਲੋਈ ਤੇ·
 ਢਾਲੀ· ਜਨਾਂਖ· ਮੌਹੀ ਦਾ· ਅੱਖ ਅਭਾਵਾਂਨੀ· ਜਮਾਨਾਂਨੀ· ਅੰਕੋ
 ਅਧਾਇ· ਧਖਤ ਮੀ· ਅਤਲੀ ਅੰਦਰ· ਜੇ ਹੈਥੀ· ਮੀਡ· ਮਹਮੁਦ· ਰਾਹੇਂ·
 ਨਾਨੂੰਮੀ ਇਥੀ ਗਤ ਵਾਰੇ· ਲਖੀ ਉਛੇ· ਅੰਦਰ ਤਾਲਾ· ਇਹੋਣੀ· ਇਲਾਲ

(૭૮)

તને જરાદા કરે અને જે પુરમાણો હુકી કરતા તથા આવડે
 તની મૂળનો ભોગોશી અલીમ તથા ભોગોશી શામ જનો જ
 માનાનો વિશ્રોભી ભીજાં જરાદા અલાહુ જન્મની કે જ જાદા
 કરે ખોટાલા તેહની હાંનાઈ જે કે ઉશાહેબો અને બદિયાં
 કાશીખૂંછે તેઘનું ચાલે હુંછે (ભોગોરની જગો) જાયદા
 અલગાળું મહમદ તકી (ઉશાહેત જમાનાનો જુનતેહ
 દશોભ મહમદ તકી હુભેશો રાખે ખોટાલા નેના શાદીએ)

(શાખશી જ ૪૧)

તે પરથરદેગારણે તો ઝીકનો અખસાનાં રાંછે જે છાંઠી અને
 અખે અતસબો તથા મજનુંનો લખેલી છે તેમાં કાંઈ ખોલાડે
 તથા પ્રશો શાહનથી જરને તેબીનાને જાણા (૩) બેદિ ભોગો

શ્રોણેલો· તથા· કુંમેલો· તથા· આલેઓ· કે· હૃતિક· જમાનાંનાં
 રિશાછે· તેણાંથોડા· તરુણીલયાર· લખીઉંછે· દીવાને· બીર· અ
 હુમદ· શાહેદ· તથા· બીરનં· અશાદ· અલાહ· હુમતાસા· દિલે
 ઉંઝણાની· તૃણલતને· ગુણાદા· કરે* કું· દીવાગો· મહમદ·
 રહીમ· શોભૂલ· દીશાલાંમ *

(શાખશી. (૧) ચી.)

ને· ઓદા· કુળરગાંછે* દિ· મેહેજરમાં· અવીશા· બાવૈ· તથા·
 પારશીની· તારીખ· ઉકાલે· તેખાએ· જે· ઉંઘર· તરુણીલયાર·
 લખેલુંછે· જે· માહારી· લજરમાં· શાહી· તાં· તેહે કીએહે· ઉંને· જે
 શાખશા· દિવાતને· ઓરી· કરી· કેહે· તેહેની· ધાત· ઓરી· તથા· ગ
 લતછે· ડિને· તરુણીલયાર· બીજાં· દિરીતેછેલે· જેરીતે· આલી·

જાણાયાએ. ઇથાથાએ. ખાલ. નશાખનો. દ્રેગુલતા. તથા. હકી
 કલનો. જાણાયાર. જમાનાનો. દીકો. અને. એક તનો. બતલીમું
 શાભીર. મહમદ. શાહેદ. નાનુંભી. તથા. દ્રેગુલતા. તથા. કમાલી
 દિતની. પુણી જી. જમાનાનો. દીકો. ભીરની. અશાદ. અલાહ. નાનું
 ભી. દીધિદ્ય. કાબેસોની. દ્રેગુલતને. ઓદાતાલા. હુમેશાંરાખે.
 છે. એ. દ્રોગેલોઘે. બહિજાનયાર. લખેણ. રૂપને. ઘરનું. વાનેહ.
 કરી. આપેઉંછે* (દીશાહેબની. મોહોર. બદામ. રોકી છે.)
 બંદો. ઓદાનો. ભૌહમદ. અભી. દિબને. મહમદ. હીરામાં ઈલ.
 અલ. હોશોની *

(શાખાની. ક ટી.)

તે. ઓદાતાલા. દિદુંછે * દી. ચેહેરાના. જેખીલા. નાનુંભ.

તथा. શીખા. અં. દિલંમનાં. જંદુજારા. લખી. ગીજાય. તે. પરમાં
નોંધે. અને. દિપાતમાં. કશો. એલાદ્રુ. નંથી*. અલી. જ્યેણી *

(ઉદ્ઘાનેભની. મોહેરો) હંદ્રા. અલી. અલ. આલા *

(શાખશી. ઉ. રી.)

ને. પરમાંણો. એ. એહેજરમાં. બીજાં. લખે લીછે. તે. આહારી.
નજરમાં. શાહી. તથા. તે હેક્ટીક છે. અને. દિ. શીતલી. બીજાં. વાચે
હ. તથા. જાહેરાંછે. તેઓ. કશો. શાક. તથા. શોભેહ. નંથી. મગાડ.
એહેલાં. માંથામાં. શાક. આચી. હો. એ. તે. કાદ્રીને. જાંદાન. તથા.
નન્દુમનાં. દિલંમથી. જંદુજારા. કામજવો. અને. તાંકેશીલ.
પાંડ. બીજાં. જી. નું. તો. જી. પરમાણો. ક્રૂલેલી. તથા. કાંભેલી.
અને. મોહેરા. આલીમ. નન્દુભીંપો. બાંસેન. કરી. ગીજાછે.

તેવંગાની ઝુલ્લાલતા તથા દાનાઈમાણિકુર્ચિ શોખેહનંધી * હું
અંદો ગૂલેહેગારા શોખ મહિમાન ભેદી વિશે ઝુલ્લાની *

(શાખાશી. < મી.)

તેછે બૂલ્લાં દાખલે બરાફલની આપણાર ઓદાનાલા *
ઉંભેહેજરમાં જીકાઈ મતલબો તથા મળમુંસો લખી છે. તે.
અષણથી તે આપૈર લગ્ની શાહી ડાખલે દૃશાત છે. ડાખલે શો
ઈ. હિયાનલે ઉજારાર નંધી કરી રાખે. મળાર લે શાખાશી. હિયાત
ને ખૂન ક્રેર જાઓ. તેને રીખાળુ. ઉલંઘથી એ અભરાં જે રી
દી જાને. હિબીનાં વંગુ. રૂખે હો હો રા. ઝુલ્લેલો. ઝાંખેલો.
ઉંલમાં. નગ્નાંભી. શ્રી. જે દુષ્ટાની. રાંનીની. વાણ. કરો છી. નથી.
ઠીદ્યાની. ભીરા. મદ્મદશા. દેખ. તથા. નીરાળે. અશીદ. અલાદ.

(૨૩)

દિનંજી. (૨) બેચે લખી રીત્યા. તે પરમાળો છે. ઓદાતાલા.

હિંદુની. ખૂલંદ. કૃષ્ણ અતસે. હભેશા. કાં વિભ. ૨૧ એ* ટું. લ

અનંત. શાહી દ્વારો મો. કુમતરીન. મોહાર. શાહી દ. કુલ. હં

ન. ડાખ. હોશોની *

(શાહી. લાભી.)

તે. ઓદા. ખૂલંદ છે* ક્રાંકથી. તારીખમાં. કુલીશો છે. તેચાત.

અશી છે. તેમાં. કર્ણ. શાક. શોભે હા. જથી. જે અક્ષે. મો દિતે બર.

નાનુમની. કે તાબો મો. લખે ખૂલે બે. આરથી. લોકોની. બંદગી.

નો. પાદિઅં. તથા. વખતની. નાનુનારી. તથા. દિલોકોના. જરૂ

નના. દાદા. ઉ. તારીખ. ઉપર છે. ફાને. આરથી. લોકોની. (૨)

બેચે. તારીખનું. બ્યાંદાન. છોટ. કેતાબ મો. નંથી. કાં એને.

આહાર. જે દિકાનો. ઘરું. મો તે બર. કેતાબો. ડાખી છો. ફાની

અહેરામાલ્યામ-પડેયને-૧૨) બેઘે-તારીખની-રાત-ઓદી-
 છે-જો-એશાલે-મોહોરા-અંગાણા-શાહેબો-ઉધાતને-લખીગી
 અથ-અને-અશુશ્વ-મોહોરા-મરતાનો-શાહીચુદ-લોકોના-
 ખૂને દો-કૃતુલત-તથા-કમાલીદિનની-મૂળનો-નમાન-નાળું
 એ-લોકોએં-દેશાણાર-અભિજા-મીર-મહુમદ-શાહેક-ઉદ્દ
 હંલ-શૈહેરનો-નાળુંમી-ઓરાતાલા-ઉહેને-શાલાંમન-રાખે-
 અને-મોહોરા-મરતાનો-પાછ-અલકાયની-લેક-અખત-
 કૃતુલત-તથા-કમાલીદિનની-મૂળનો-મીરની-અશાહ-મ
 લાહ-ઉદ્દેહ-શાહેબો-ઉદ્દેહાલ-અશ-એ-હોજરાન-ન
 કૃશીલાલાર-અશેઅન-કીદ્યુછે-તે-પરમાણોછે* લ
 અનાર-ગુલેહાર-અંદો-એદુમદ-ઉલરાહીન-કળબીની*

(૮૪)

(શાખ શી. ૧૦ મી.)

તે. ઓદા. બૂજું/રોણે* ઝારશી. તારીખ ની. ક્રેઝ્વી ઉલ. તથા. ક
 બીરાની. બીજાં. હિંદી તે. છેકે. લે. રીતે. ડ્રાઇ. મેહેજરમાં. લએ
 જીછે. ડ્રાને. કેફોઈ. ક્રેહેછે કે. ખારશી. લોડોની. (૨) બેચે.
 તારીખ છે. ડિ. વાત. ઓદી. છે. ડ્રાને. કે. પરમાં જી. મોહો રા. મર
 નબાનાં. હુક્કીઅત. તથા. મારકૃતની. ખૂંજું નાં. ભીર. મહમદશા
 દેશ. તથા. ભીરનાં. ડ્રાસાદ. અલાદ. ગંગું મી. બ ડિપન. કરી
 ગાડ્યાય. તે. પરમાણું છે* લખનાંર. બંદો. મહમદ. શેહી.
 તોંદ્રા. નોંદ્રા. *

(શાખ શી. ૧૧ મી.)

તે. ઓદા. બૂજું/રોણે* ડિ. મેહેજરમાં. લએબી. બીજાં. લોટે-

તેહેથાં ખૂંતલમાં ખોલાડું નથી. અને આંહોરાં મરતઘાતાં.

આજાં અભિજાનાં ક્રીષીલતાં તથાં કમાલી વિતની ખૂંળાં.

અંગીચાં મહામદ શાહેજાં તથાં નીરાંને અશાદ અભાડું હિંજાં.

(૨) એ હિંજે તે ચૌઝાંની કાબેલી વિતાં તથાં નાલ્યુભાનાં હિં

અમાં આંહોરી હશાતમાં રાખે છે. તેમાં કર્ણા-શાહું શાહો બેનું

નંથી * અભનારાંધાં મહામદ રાજાનાં હુરાંની અપસ હોરોનીં

શોકર. પરવર્તનેશારનાં અને રાખાંમાં તેહેનાં વંદપો. ઉંઘ

રાંને. લોક. ક્રે. પાદ. તથા. ખૂંનંદાંછે * હુદે. શારેને જ

હેર. તથા. માલ્યુભ. થાંએને. ક્રીષીની. તારીખની. બીજાં. તથા.

કુખીશાનાં હોમોરની. હુશ્રીકત. કે. પરમાં હું. તરેરી લયા

૨૦ ડાઉન કોર્પોરેશન અને લાયિર્સ એટલી છે. તે બીજાં ધર્મિઓ મશાફુર.

તૃતીય અનુભૂતિ અને કોઈ વિવાત ને ઉનખાડું નથી. કરે જો.

કદાચિ. કોઈ ઉનખાડું નથી. કરેતો અને રામજાયું જો. તે ધર્મિ.

નન્દુભનાં. ઉલંમની. ધર્મિ. અનુભૂતિ. રામજાયું. નથી. કરું જો.

વિવાત. તમાંમાં. નન્દુભની. કેતાખોમાં. લાયિર્સ એટલી છે. બલકે.

૩. કુદ્રાશી. તારીખ. તમાંમાં. તારીખો. કરતાં. ધર્મિ. મશાફુર.

૨ છે. કરું જો. કુદ્રાશીઓનાં. ઉ. તારીખ. શરૂવે. તારીખો. કર

તાં. અગ્રાહી. બની. કરું જો. લોકો. પાણી. કોઈ. તારીખ. મ

કુનાં. તથા. દાહુડાની. ગાંગુલાની. કરતાં. કરું જો. નથી. હતી.

માંકુ. જંમશોદ. પાદશાહુ. એ. તારીખ. બાંધી. અને. આ.

શરૂ. (૪૦૦૦) એસ્ટ્રાર. હુલર. વરશા. લગ્નિ. પાદશાહી. લો

કોની. પાદશાહી. ચાલી. તાંહાં. શ્રુધી. ઉ. તારીખ. પર.

અમલા. કુરતા. આવેએ. અને. નમાંભ. મોહીરા. તથા. હો

અંમા. તથા. પાદશાહો. છ. ૩૫૨. અમલા. કુરતા. અછે. દિજાદે

જરૂર. બીજ. શોહેરીદ્વાર. લે. છેલલો. પાદશાહુછે. તેના.

જમાના. જુલી. [૧] જેવારે. હિ. લોકોની. પાદશાહી. જાતી. રહી

અને. હિ. લોકોની. આલ. લખા. રસાંભ. તથા. ઉભાદત. જાતી. ર

હી. સેહંપારે. છબીદ્વાનીચાલ. તથા. મહીનાંધો. તથા. વરશાંદી

ગંગાતરી. કે. લે. ૩૫૨. હિ. લોકોની. ઉભાદતનો. પાદશાહો. છે. તે

બી. કંડીગેરી. કે. અનુ. [૨] તુજા. મુદ્રાદાનાંભની. કે. તાંદ્ર. લ

[૧] હ. જગોદ્રોમે. લખેઉંછેલે. કેવારે. હિ. લોકોની. પાદશાહી. જાતી. રહી. અને. હિ. લોકોની. આલ. તથા. રસાંભ. તથા. ઉભાદત. જાતી. રહી. તેવારે. અભીરાની. આલ. તથા. મહીનાંધો. તથા. વરશાંદી. ગંગાતરી. કે. લે. ૩૫૨. હિ. લોકોની. ઉભાદતનો. પાદશાહો. જેબી. કંડીગેરી. (હિ. લખેઉંચ) તેની. મુંગાહ. પાંને. ૧૯ મે. જી. વે. વો. ર. કી. જી. લી. છે. તેથાં. ચેઅા. બી. આલુંભ. કરવી *

[૨] તુજા. મુદ્રાદાનો. અચાંદનાંદ. શોભ. અન્યુંનાંદ. અહમદ. ઉભને. ૩૫૩ઠું
અ. તાંદ્ર. નાંભનો. *

માંમાં જુલેમાં કરીમાં છજ્જેણે. તેને કેતાબમાં ઉપાલનો. હિંદુઓ

છે. તેને કેતાબની. ઉપાલત. આ વિભગો. જાહી. જગ્યાં ઉચ્ચ.

અંગાલા. જમાનાં માં. પારશી. લોકો. (૧૨૦) ઉછ્વાસો. વીશ. વરશી.

માશ. (૧) ઉફનો. કલીશો. કરલા. પંથા. હુલબા. જમાનાં માં. તે

રદીમાં ઉઠ્ઠિએચી. ઝાંખેનો. હિલોફોની. પાદશાહી. આઘેર. કાઈ.

કેતાબની. ઉપાલત. હર્દીમાં. પુરી. ધાઈ * વળી. લારીએ. વશા

કુનાભની. કેતરાય. (૧) ઉછ્વ. કે. તમાંમાં. તવારીભની. કીતા

ખોમો. ખોતેભર. કીતાબુછે. તેમાંનેજગો. ડાલંમનાં. લોકો

ની. તવારીખન્યુ. બખેદાંન. કીધ્યુછે. તેજગો પર. તેને કેતાબ.

ધાલો. કૃતમાનેછે. હિંમાને. લખેછેને. પારશી. લોકોનું. કાંમ-

તથા. કીરીઆ. મારગ. પુરી. વરશા. ઉપર છે. માશ. (૧૨) બાર.

હરેક. માશ. (૩૦) તીશ. દાહુડાનો. ડેને. પરશા. (૩૫૦) તરણ

શોઅંને શાઠ દાહાડાનું અને દિન (૧) પાંચ હર વરસા ઉં
 રૂબ્રાયાં ભારુની અથવા અશાઢાર મારુની પાછલ વ
 ખારેણે અને નેહેણે અંગશે અશાલરફે છેદેણે તે વેલા કબી
 શોંગણતરીઅં લેતા નંદી (૧૨૦) દિક્ષાં ધીશાં વરશી ઉં
 આથાનો જબીશો કરેણે કે લાખની દિવારત હીનું પૂરી ધારી
 હુંને લે બોઝો કે હેણે કે દ્વારશી તારીખ (૨) બેઓ છે અને પા
 દ્વારેની તથા પરસ્પર ગાર લોડોળી તારીખ જૂદી છે દિવાત
 ઘણી ખોલી તથા બેલણે અને દિવાત શાબે ત કે તારીખી ન
 થી નાં અને હી બોહોડાની ચાત છે અને ઓલમાં લોડો અં
 થી અંદેખોખોખી (૨) બેછી તારીખનું નાં નીશાંન છોઈ
 કે લાખમાં લખેં નથી અને દિજ તારીખ વગરે બીજી તારી
 ખનું ખાંદેખાંન છરીઓ નથી — અને લે શાખા (૨)

એ તારીખની પાતાઓલેયાં તો જહેલાં તથા નાંદાં નછે.

૩૫ને ૬૪ તથા ૫૨ વાતથી અંગણનાં થાહિમાં ૩૫ને નેક-

ભારગથી પોતાનું રાર મૈરવેચાં ૩૫ને ૩ તારીખને બાંદ્વચાની

બીજાથી માલ્યામાં પડેયાં ૩ તરીકોએ ઉલ્લંઘાં તથા

હુંકારાં લોકોથી બીજાલોકોએ કાં ઉલ્લંઘાં ૩૫ને તારીખની ચાલની

(૧) પાંચાં દાહાડાની ૫ શાંતને (૧૨૦) દિક્ષાં પીંશાં વરશાં

લગ્ની ઉલ્લંઘાં ૫૨થી ૩૫ને તેઝેને મુંઝી નાંદી વેની ૫૨થી લખી

ગીયાંચાં તો ૬ લીલથી માલ્યામાં પડેયાં ૩૫ને ૩૫ને

શારી ૫ઘે નીગાંડું રાખ્યાં ૩ કીને ઘરુંની થોડાં શાઈ તથા તા

કીદ ૩ કીદીએ ૩૫ને ઉલ્લંઘાં તથા હુંકારાં લોકો ૧૦૧૨ હેલી

ભારીકીને તથા ૩૫ને ૩૫ને ૩૫ને ૩૫ને ૩૫ને ૩૫ને ૩૫ને

એ — બીજાં ૬ લીલાં એ હેલે ૩૫ને ૩૫ને ૩૫ને ૩૫ને ૩૫ને

તથા· અહીનાં પોના· નામ· અશાસ્ત્રાં અને· તે· નામ· કુરેશાતા
 અનાં· નામથી· લીધાં છે· અને· તે· કુરેશાતા· અને· હોકમાં· ભો
 પો· પાણ· અશાસ્ત્રાં કરી· કેદેછે· અને· અદ્ભુતાનું· જેવા· કુદીએ·
 લોકો· કેદેછેને· હિ· કુરેશાતા· તમાંમાં· આત્માતની· પૈદાજિશ· ઉ
 પર· અશાસ્ત્રાં છે· અને· હિ· એ· વાત· ઉપર· હોકમાં· લોકોમાં· જ
 ધડો· યાસેં છે· પણ· હુક્માંનાં· હોકમાં· લોકો· તેદેખીજ· કરીને
 કેદેછેને· હિ· કુરેશાતા· અદ્ભાતાલાની· નજીવીજ· રાખી છે· —
 ઠિકાને· બંદાઓની· તરકુથી· હુક્મતાલાની· હસ્તુર· અરજા· પ
 રનાંરાં છે· અને· અહીનાં· તથા· વરશાનો· હરભેદ· દાહો· એ·
 કુરેશાતાઓના· નામ· શાખે· તાલ્બુદ્ધ· રાખેછે· અને· હરભેદ· દા
 હો· ને· કુરેશાતાને· નામનોછે· તેની· ઉભાદત· ઉદ્ઘાની·
 અને· બરાફરાર· રાખેલીછે· જેમને· ખોદાને· પીછાનાંર

નોંધો. કુકીમ. શોભ. શાહાયુંદીન. શેહરવરદી. હેડમતોલ.
 અશરાંક. નામની. કેલાભમાં. બોલી. ગીઓચ. તે. દિલારત.
 ડાદિ. રીતેછે. — કેહેલેજ. કુલશી. લોકોના. હોકમાં. લોકો
 ઝૂલ. એમ. કેહેલેજ. ઝૂલ. પેદાઉંશ. ઉપર. કુ. આશામાંન.
 તથા. કુ. શેતરા. તથા. બીજી. દોનીદ્યાની. વશતુ. કુરેનો
 દિક. દિક. શાહેબછે. હિંગાને. હુરકિક. ચીજ. ઉપર. દિક. દિક.
 રેશતો. મવલલછે. કાંણ. કુંધીછે. પાણીનો. બી. દિક. કુરેશાતો.
 . શાહેબછે. અને. તે. કુરેશાતાને. ખોરદાદ. કેહેછે. ઇન્ને. અંગ
 રનોબી. દિક. કુરેશાતો. શાહેબછે. તેહેને. અંગરદાદ. કેહેછે.
 અને. અતશાનોબી. દિક. કુરેશાતોછે. નેહેને. અરહીબેહેશાત.
 કેહેછે. અંને. દિ. શાંધલા. જુરાનીછે. અને. મોહોર. ઇકીમ. ખો
 કો. જેમધ્રે. અંભાદકોલેરા. તથા. કુશાગોરા. તથા. હૃમણ.

तथा अद्विलाल्दन एवरे होइमां लोको एवं पातनो ईशारे
 लभी गीत्याच ते पातो होइमां लोको वत्सेगे अमांम लोको
 (ईत्याने वगर अद्विला) शंभु शज्जे नहीं — की ताभनी
 इत्यादत्त पूरी थाई — बीज्यं अभीशानी अल रारशी लोको
 नां प्रादशा होमां असाहुरु तेथी इम अलंभ अडेयने प्राद
 शाहीनी तथा परहेजारोनी ताशीभ इक्क दुती आहिले
 पारशी लोकोनां उलमां लोको अही गीत्याच ते परमाणु
 प्रादशाहो नहीं आली प्रादशा ही कुरता हता व्यलगे पर
 हेजारी तथा इत्यादतनां अंभमां अहु अभेल हता
 आउजे थोडो उक्क अहेवाल ताशीभे ओळखनंभ नांभनी
 केताप्प आंधी आलंभ अडेय अपने तेकेताभमां पारशी
 नां प्रादशाहु लोकोनो अहेवाल अपने वली केवला ए

કારણીલોકો હિન્માદશાહોને પેગંમખર લથા ઓદના
 વલી કરી જાણોય કાંદું શ્રુતી કે કેવલા દશ લોક કેદેબે
 કેખશારો અનુતો ગોડામાં છે તે આખર જમાં નાંમાં જાહે
 રુ ધારો ડસે ઉત્તાખ રોહેરમાં કિશે લગ્નાં છે તે હેને કળ
 જ કરી કેદેબે લેજવા કિશે પાહાડમાં ડસે તે પાહાડમાં
 કિશે ગારું તે ગારું ને શાર્વે લોક જાણોય ડસે કેદેબે
 ઉંગારમાં કેખશારો ગોય થાઈ ગીયો છે ડસે તે જગ્યો
 કંઈ તરીકે નાં મોજેણ તથા અનુભિંબાં કાંમાં જાહેરથા
 મીય ડસે પારણી લોકો તે જગ્યાખર ગારું તાત કરું
 ને શાર્વું જાણ્ય ડસે હૈકમતને ડશારાખ જાંબની કેતા
 બમાંબી કેખશારો નાં મોજેણ બાબી તથા બંદોરી ઉ
 બાદતને બાબે લખેલું છે ડસે વલી ઝૂનેલે મૌહિકા

અલોમેશીરાજુ - તેજ - ક્રૈતાભની - શરેહુમાં - કેહેછે - ૫૧૮
 થાહુ - કૃતેભંદ - કેખશારો - મોખારક - કિનો - હુલો - મરાકી - ત
 થાંખુસગીભાં - પછે - શારોશો - ચાવીને - દિહેને - કહેઠે - તુંખેલી
 કેહુનની - તરરે - આસ - ઓદાતાલાલા - હોકંભથી - અને - તે -
 પરપરદેગારનું - મોહુ - જો - — ઉભલી - ક્રૈતાભની - દિખારત
 મુશી - થાઈ - — અને - પરાતુ - નામની - ક્રૈતાભથી - જહેર - આ
 એથને - મારશી - લોકોની - દિખાદતનું - કાંન - લથા - કારખા
 ર - રારવે - હેજ - તારીખ - ઉપરછે - — હુદે - ઉંશાધલી - લેહેકી
 કાતથી - જહેર - થાઈઓને - જે - દીખાયા - કાંબી શાને - ઉંનકા
 ર - કરીય - અને - એ ઉંલારીખ - કરી - ઓલેય - ને હને - જાર્ય
 અના - ઉલંસની - કશી - અભર - નથી - અને - મારશી - લોકી
 ની - દીન - માહીનાનીબી - અભર - નથી - — દીનાને - જી

શાખશા. પારશી. લોકોની. દીનભાં. દીનદાર. હૃતે. હુ. લોકો
 નાં. તરીકા. ઉપર. કાબેલ. કંદા. હોદ. તેહેને. ધરેયાને. ઉપ
 ૨. લખેચા. પરમાણો. જીવીશાને. તથા. મહીનાનો. તથા.
 વરશાની. ગંગા. તરીકે. ૨૭૧. રાખે. ડિને. ખોતાનાં. આગામા
 અદીન. લોકોનાં. તરીકા. પરમાણો. દિબાદત. જે. મુખરસ.
 મહીનાં. તથા. દાસ્તાનીછે. તેહેને. ૨૫૧. રાખે. નહીનો. તે.
 શાખશા. પારશીનાં. તરીકાથી. આરજ. હોડ. ડિને. ખોતે.
 પારશી કર્ણાનો. દાવો. નંહીકરી. શાખે. એછીતો. અંગાનાર
 ઓદાતાલાછે * હુ. શાખશીનો. લખનાર. બંદો. ઝૂના
 હુ. આર. અહમદ. ચીરામદીબ. હુ. બને. અહમદ. હુ. શેન. લો
 ઘુ. તોખી * આહુ. મેહેજરને. મુરો. કીએ. તે. કાંન
 નો. દ્વાધી કાર *

(શાખણી. ૧૩ મી.)

તે. ખોટા. ખૂલં દુષ્પ્રે * પારસ્યી. લોકોની. તારીખ ની. બી
 ના. તથા. કલ્યાણની. કેદીદ્વિત. ઉ. તારીખ. ઉદ્ઘાલે. તે.
 શોધા. એ. બીજી. તારીખ. જાથી. તે. હક્કીકત. જે પરમાણે
 ઉશાકૃહાન. શોહેરના. નાનુભી. લોકો. એ. મૈહેજરમાં. અહિયાં
 ન. કરીગીદ્વાચ. તે. હમાર. કર્શે. એ. લાકૃ. જાથી. ખોટા. તા. લા.
 ઉ. શોહેરને. ખૂલ. અ. લા. એ. ને. ગા. હુ. રા. એ. લા. જા. એ.
 પ્રા. મતશીળ. અ. અ. દૂલલા. કંમશોહે *

(શાખણી. ૧૪ મી.)

તેઢે. ખોટા. તા. લા. * પારસ્યી. લોકો. ના. કલ્યાણની. બી
 ના. તથા. ઉ. લોકો. ની. તારીખ. ની. હક્કીકત. ધર્મ. ચા. જે. હે
 તથા. શારબેને. રોશા. લા. એ. ઉદ્ઘો. ને. આ. એ. એ. શા. શા. એ.

હંનથી * લખનાંરં બંદો અહમદાચયલી શ્રી દિશારૂહાં

[૧] જનાં પાદશાહી મજાનનો * હલાંતર *

(શાખશી. ૧૫ મી.)

ખોદા * કેઝાંઈ. ડ્યાઉ. કાગળમાં લખેલુછે. તે નન્દુભી
તથા. ઉલમાં લોકોનાં કોલની. આંકૃત્ય છે * (હ. ૨. ૩. ૩.
નો. ૪૨ નાં ૨૦) શાહીડિપુદુ. તથા. શ્રી દારારોમાં. કંભતરીન
બંદી. હાજર. મીર. અહમદ. વ્યાશ્રી. વ્યાજર. મુર્ગી * શાખ
દ્વારા. અહમદ. બાકર. ટિલનો. અહમદ. હોરોન. રામલ. હોશીની

[૨] હલાંતર * એ. બોલની. મારુદિની. રિલે. દિલ. રામોહશાન્દુ. નામચે. તે
ઓહદી. વળુરથી. કિનરતોછે. રામનો. બીજા. પાદશાહી. રામલસરારી. ૪૨
તરા. ઓદીશોછે. રામનો. કુલ. શ્રીહેર. તથા. ૨૮ રેતનાં. ચાંમનાં. રામભતી
દ્વારાની. રામનાંરની. કેહેછે *

(શાખાની-૧૬ મી.)

તે. આંદા. પુણ્યજરગણે * કૃતસ્વા. તારીખન્યુ. વડુદ્ધાંજ.
 ઉ. રીતે. છેકે. લે. રીતે. આ. હોસા. અરતભાનો. આ. કુ. કુલા
 અનો. કૃષ્ણલનની. પુણ્યનો. તારીખ. ૧૯૮૫૩. લોકો. આ. મો
 હોઠો. કિકો. જમાંનાંનો. મીર. મહિના. ૧૧૬૪. નાન્દુભી. તથા. કૃ
 શલતની. પુણ્યનો. પૂણ્યજરગ. લોકોભાં. ઉંમદો. મીરાં. અશા
 દ. કાલા. નાન્દુભી. હૃદાલા. દિવ્યોની. કૃષ્ણલનાને. ગુર્ભા
 હે. કરે. ઉ. વીર. શાહેબોહ. લે. વડુદ્ધાંજ. કરેણે. તે. પર
 માણેણે. કુલનો. ઉ. શાહેબોહે. નાન્દુભ. તથા. રીઅંગ. દિલ્લી
 અભા. ભારી. અભરણે. તેમાં. રાષ્ટ્ર. રોબેન. નથી *

(ઉ. રાહીનો. કરનાંર.) કુશાદપોભાં. કંઅલરીન. અહમદ.
 કુશોન. છોકશો. અરનાંર. કુશા. શાહરાની *

(૧૦૧)

(શાખશી. ૧૭ મી.)

મોટા. મરતબાળા. તમાંમ. ૧૯૮૩૫૬. જો કો માં ચૂંના દા. ૨૧૨.
 મહુમદ. ૧૧૬૪. લથા. મીરબેં. ૮૫૩૧૬. અસાહુ. ઉ. વ્યે. હુ. ૧॥
 હુબો. નજૂમનાં. દિલંમભાં. માહેર. લથા. ઉ. દિલંમભાં. ખૂરા.
 પાકાછે. ૩૫ને. જેકાઈ. ૩૫૧. મેહેજરભાં. લખેલ્લુછે ને. એ.
 લોકોનો. કોલછે. લેમા. કાઈ. એલાક્ષ્મિન્દી. * હુ. લંખનાર.
 પંચતરીન. જોકશે. મરનાર. શાળા. હુશાંન. મહુમદનો. * (એ.
 શાહેબની. મોહેર. અદાભીછે.) મોહુમદ. ૩૫લી. વીને. હુશીન.
 મહુમદ. *

(શાખશી. ૧૮ મી.)

મોટા. દરજના. ૧૧૪. અલકાબ ના. ખૂગુલત. લથા. ૫માંલીઅત
 ની. ખૂગુલના. ૧૧૬૩૫૬. લોકોભાં. મોહીદા. મીરા. મહુમદ. શા. ૧૬.

(૧૦૨)

તथा· ભીરાં· ઇયશાદ· અલાહ· ઉ· શાહેબો· નાન્દુમ· તથા· રીતા
 અ· દિલંભમાં· આહેરફે· ઇયને· ઉ· લોકોઉ· જે· બીજાં· જખીછે· નેમાં·
 કાંઈ· એસારુ· નથી * (શાખાનો· કરનાંચ) હાજી· લોકોમાં· કંઈ
 તરીન· મોહુમદ· જાહેર· ઇબને· હાજી· મોહમુદ· હોશાંન *

(શાખાનો· ૧૮ અ.)

તેણે· ઓદાનાભા * ઉ· મેહેજરમાં· લેકાંઈ· લખેલ્દુછે· નેમાં·
 કશો· શાહ· શાહેબ· નથી· ઇને· કરીની· રીતે· એલારુ· નથી * ત
 માંમ· હાજીઅબોમાં· કંઈતરીન· મહમુદ· ઈન્જાહીમ· ઓકરો·
 કરનાંચ· હાજી· મહમુદ· હોશેન· બીજાં· હુજુ· બદીઈનો *

(શાખાનો· ૩૦ અ.)

તે· ઓદા· પુજરીઠે * લેકાંઈ· ક્રોનશી· તારીખ· બાબેતાં
 પ્રબીશા· બાબે· ઇયા હિ· મેહેજરમાં· લખેલ્દુછે· નેમાં· પ્રશ્નો·

(૧૦૩)

શક્તિથાંખેલાડુંનથી * અભનારં છોકરો અરનારં

કાળું મહમદ કાળં મનો * મહમદ રાયલી *

(૨૦૫થી-૨૧ થી-)

ઓદાં શારવેનો શાહેબુછે * રાહિં મેહેજર રમાં જોકું હું ઓડા-

મરતથાનાં પાછાં અલ કાબુનાં ઝુણું લતાં તથાં કમાલી રાય લ

ની મુણું નો રાહુચ્યદાં સોકોભો સુનંદી તથાં જમાંના

નો બલલી ભૂષાં રાગાં મીરાં મહમદ શાહેલ તથાં હકીક

તનો અંદાનારં અનો ઝુણું લતાં લતાં તથાં કમાંની દિતની દશાત

ગાણનો ઘુણોરીં લોભોભો ઉમદો જમાંનાં નો ઉણો મીરાં રા-

યશાદ રાલાહું ઓદાંખે તાલાં હાં બેઢાં શાહેબો ને શાલાં મ

તાં રાખે જોકું હું બુધેચ્યાં નથારાં લખી ગીતાય લે અર્દું છે

રાયને હિંબેદું શાહેબો રીચાલ તથાં જળું મનાં દિલં અમાં

ખુલ્લી-અભર-રાખી છે. ડિને-હિ-બેં-ચાના(નો નો- ઓ-ન- ૨૧૬)
 તથા-ઉંશતારાર છે. તેમાં કાઢ-એલાદ્ય-જથી * (૬-૨૧૬
 નો-કરનાં) હાજી અપોમા-કંમતરીન-નો હુમદ્રિબને
 હાજી-ડિવલ્દુલ-મળ્ણ ૬ *

(શાખશી-રહેંભી)

ઓદાલાખા-૨૧૨ બેનો-શાહેબ છે * કોકાઢ-અંગ-બેહેજ
 રમાં-કૃતરકી-તારીખ-વાબે-તથા-કબીરા-વાબે-લખીઉ-
 છે. તેમાં કશો-શાક-શોબેહ-નથી. ડિને-નો હોટ-મરતા
 ના-ખાત-અયલકાખના-હુક્કીજત-તથા-કમાલીહિતની-કુળ
 ના-૨૧૬૩૫૯-લોકોમાં-ચુંનેદા-અંગરા-મીર-મહમુદ-૨૧૬
 ૪-તથા-મીરબં-ડિશા-૬-અલાહ-ઓશ-હ-બેહને-૨૧૬
 મત-રાખે-હ-બેહને-૨૧૬-નાનુભવના-દિલ્લિમના-આહેરાદે-

(૧૦૫)

અને લોછો જે કાંઈ ઉભાબે બોલે તે મોહો હી હોજતાં અણા

વી. તેમાં કરણો રક્ષણથી * (અને શાહીનો કરણાં) અથ

દ્વારા કાંઈ લેખ ઉભાને મહમુદ કરણાં *

(શાહી - ૨૩ અને)

ઓદાતાસાનું નામ શારપેનામ કરતાં લલુછી * શારણી-

લોછોની. તારીખ નું વિદ્યે કરીનાં અને કાંઈ ની એવી અ

તા. લભા. તે હેઠી. ૭૫ જાની ૫૯. કે. ૫૨ માં ગે. મોહોદા. કરતાં

ઘાના. પાક. ક્રિલ કાંઈ નાં. હુક. તથા. ઘારીક. વાતોના. શાંમ

જનાંસા. કરતાં. તથા. જુજરૂની. જરેલા. મીર. મહમુદ. શાહે

ક. લભા. મીરના. અશા વ. અલા. હ. હુક. તા. લા. એ. બેદુંની. રૈ

જલલને. જાદા. કરે. એ. બેદું. શાહે. એ. જલ્દુંમ. તથા. રીઘા

જી. કિલાભા. એ. બેદું. એ. કરે. એ. જાહિ. એ. હેજર. માં. જી. કાંઈ.

(1, 5)

બહિયાનાં કીથું છે. તેમાં કશો-રાજ-શોભે હું જથી* (અ-
શાહીનો: ૫૨નાં ૧૦) રૂપા દહ્નાં મહમુદ-જાફર*

(૧૧૭ ૨૦-૨૪-મી-)

ઓરાતાલાન્દું. નામ. ખૂલ્દં ૬. ૩૫ને. બ્રાહ્મત ૬૧૨ છે * આ
ઉ. મેહેજરમાં. જોઅંઈ. ક્રારશી. તારીખ. આવે. તથા. પુણી
ક્ષાની. બીના. તથા. ૬. તારીખ. ૧૫૭ છે. તેથાએ. લખીએ
છે. તે. ક્રાનોલ. તથા. કાબેલોફ. બિટ્ટાન. ક્રીડ્યું છે. તે. અ
સુંદુ. તેમાં. કશો. એલાર્ડ. નથી * લખનાં ૨. ૩૧૨ વે.
હાલ અમાં. કંમતરીન. મહમદ. આદી. છીકચી. મરનાં ૨.
૩૧૩. મહમદ. અલીનો *

(શાખાની રક્માણ)

ઓ હાતાલાં કરવેનો શાહેબ છે * એકાંઈ. કુલશી. તા

(૧૦૬)

શીખ. બાળે. ચાહિ. મેહેજરમાં. લખેલું છે. તેમાં કશો. ખેલા
 કૃનથી * લખનાર. હાણાઓમાં. કંભતરીન. અહમદ.
 મેહેરી. ખાલરે. મુરગી *

(૧૧મદ્રા-૨૯મી.)

તેછે. ઓદા * કુરકુરી. તારીખમાં. કલ્પી રીં. તથા. હિ. તારી
 ખ. હિન્દુનાંદે. તે. વાત. અગ્રીછે. જો. પ્રમાણો. ચ્યાહી. મેહેજર.
 માં. તરુણાલયાર. અહિચ્છાન. કીધેલું છે. તેમાં. કશો. ખેલા
 કૃનથી * લખનંગ. અદો. ગુલેહુગાર. અહમદ. જવાહ. અ
 રનાર. હાણા. અહમદ. અલીનો. છોકરી * અભદ્રુ *
 જવાહ. બીજા. અહમદ. અલી *

(૧૧મદ્રા. ૨૭મી.)

તેછે. ઓદા * ચાહિ. મેહેજરમાં. જોકાઈ. કુરકુરી. તારીખ

(૧૦૮)

બાંધો તથા કબીરશા બાંધે લખેલુછે. તેમાં કથો ખેતાણ
તથા રાજ નથી * (લખનાર વિદો કુને હગાર મોહમ્મદ
કુશોન મરનાર હાજ મહમ્મદ અલીનો લોકરો *).

(૧૧૦૫ કૃતિ ૨૮ મી.)

તેણે હાના * મોહોર મરનાના પાઠ અસાધનાના.
કૃતુલતની મુશ્કેનાં શાલ અદ લોકોના ચૂંને દા જાનાના
નાં દીકા મીર મહમ્મદ શાહેક તથા મીરનાં અદાદ અલા
હુ. દિ. એઉ. શાહેબો ન જૂમા તથા શ્રીમાળુ. દિલંમભા. ધ
રાં. આં. દૈરાણે * (લખનાર) અલલા. હો. મોહમ્મદ. અ
લી. મોહમ્મદ. હો. શેન *

(૧૧૦૬ કૃતિ ૨૮ મી.)

ઓદા * દિ. મેહેજરમાં જી. બીનાં. લખી છે. તે. જી. ૫૨

(૧૦૬)

માંગે. મોહોરા. ભરતભાનો. પાક. ડિલાયના. કૃષ્ણભન

ની. ખૂળના. તમાંમ. કુલેલોઆ. ઉમદા. તથા. તમાંમ. શાહીઅ

દીમા. મોહોરા. કામેલ. નજૂમી. ભીર. મહમદ. શાહેશ. તથા.

મીરાન. ડિશાદ. ડિલાહ. કિ. કંણ. (૨) બેદ્ધ. બહિભાન. કરી.

ગીરાથ. તે. પરમાણૂછે. તેમાં. કશો. એલાકુ. નથી* (લખ

નાર.) ગુંજેહેગાર. બંદો. ડિશા. જ. ભરનાર. હાજી. મહમદ.

ઈલરાહીમનો. છોકરો *

(શાખરી. (૩૦) વી.)

વેદાઈ. ડાહિ. મેહેજરમાં. લખેલુંછે. તે. કોશા. તાદ. જો જોનો.

ઓસાંછે. તેમાં. એલાકુ. નથી * લખનાર. બંદો. ગુંજેહેગાર.

હાજી. ખૂલા. ડિલી. નથી. ભરનાર. હાજી. મહમદ. તથીનો. ઓ

કરો. મદાહુર. ડિશાનુંડ *

(૧૧૦)

(શાખારી. (૩૧) ખો.)

તેછે. બૂલેદ. ઓદાતા લા * જે કાઈ. હરાદ. બેહેજડ મા. લખી
 તથા. અને. મોહેરા. મરતાના. પાક. અનકાયના. કમાનાના.
 વિકા. શાઈ. વિદ. લોકોમાં. ચૂંનેદા. ર્યાગા. નીર. મહનદ. શા. દેક.
 લથા. નીરલે. અશાદ. અલાહ. દિ. બેહે. શાહેઓ. દે. જે. કાઈ.
 લકુશીલવાર. લખી ઉંસ. તે. બૂલેદ. કાણકે. હલોકો. દિલ
 મા. પાકાંદે. લથા. લખુમલા. દિલંમની. શારી. અભર. રાખે
 અને. મશફૂરાંદે * (લખાન(૨)) મંત્રતરીન. અહમદ.
 કોનાંમ *

(શાખારી. (૩૨) ખો.)

સેછેઓ. દા. ક્રારથી. લોકો. ની. તારી. મની. બી. ના. લથા. દે. લો. કો. ના. ૪
 બીશા. ની. કે. ક્રુષી. અત. જે. પરમાણૂ. મોહેરા. મરતાના. ૫

કુંડલકાખનાં અને હજત તથા બુંગરૂળીનાં શાહેબ-
દાગાં મીર મહમુદ શાહેબ તથા મુખેલ કાંમેલ મીરનાં
અશીદ અલાહ એ બેદું શાહેબો લખીગી રાય તે પરમાં
ણોછે અને અભિજનાં વખતમાં દિલ્લીની અરાધર જન્માન
નાં હિલંમમાં ઓઠ અખ્રદાર નથી અને ઓઠ દિલ્લીને
રદ કરી નાહી શાખ તો * (લખનાર) ગુનેહરાર એ
દો મહમુદ હિલરાહીએ બીજા હાજુ મહમુદ એ ભી દિશા
કુરુની *

ઓદાનાખા શરનેનો શાહેબ છે.

એ મેહેજર ઓરોડા અધ્રાખરો તથા હોરચત જરેલા બું
નેરીના પાર શી લોઓની દિલજેભાશચી ચાંદ છું છે * તે

શાહેબી લાંનાનલી વીજાત કરું હોય કે

અધેખાર્દું હોરમણણું અદ્વિતીયાં

કાણેખાર્દું હોરમણણું અદ્વિતીયાં

અધેખાર્દું પેશાતંત્રાનારોગણાં

અધેખાર્દું હોરમણણું શાહેબાં

આડીચાળું અદ્વિતીયાં

આરથી જનશોદ્ધાંત્રાં

આડીચાળું બંધાં ધીરણાં શોદ્ધાંત્રાં

આડીચાળું તથરોજાનું શોદ્ધાંત્રાં

આડીચાળું ઓરણોજાં કુંશાંત્રાં

આરથી ઓરણોરણ માટેકણ દારાં

આરથી કૃષાંત્રાં બ્લદ્ધાં કાળ રારાં

આરથી કૃષાંત્રાં શારોશોશોરાંત્રાં

એસાનાઈએરનાનાં મુખાં

આરથી હોરમણણું નાં પદેલ

આરથી મંજાંચેરણું હિલણું મુરજાંથાલાં

તમાંમંથાએદ્યો શી ઉંઝાંઝુંનાં દ્યો લ

માંધોનાં મેહેજરનો લર જુંનો

શાહિનીએં લખે ચું મેહેજરનો યાઈ ઉદ્યમે ને મોહેવા અરનાનો
 તથા ભૂલંદ અકાંનો હીજતનાથા તેજબખલીની નીશાં નોંધા
 રસીદોનો ચું જે ૨૦૧૦ લોકોના ચોમદો રોડ અરદોદ્ધ માણ્યો
 શરાફે અરાલ મેહેજરનો રાશાની ઇક્કી ફળ તથા તે દુનાં ઉપર
 અશાલ શાહીના અરનારાયોની શાખે લીની વાખું તમાં આંદ્રૂન
 અઠી બંદરમધે લખાયી છે ॥

[૧]

અંદું કૃતી સ્તુતાધીયાં અને જાં મેહેજરની અશાલ મારશી દિલ્લાના
 શાહિનીઓનાં અને જાં ને દિલ્લાની તુંના દ્વારાનોં ઉભયાં ચું ડીપુછે કે આ
 જ્યુભાં એટાં કુલાં નાં દ્વારા હેરાયો હે એ મેહેજર અચીકું છે ને દેખો એં ત
 રઘૂનો છે અને ઉભયાંની નીચે નો કે અરાલ મેહેજરનો તરફ જુદો છે ને દેખો
 શાહુંધા તમાં રોડ ખોડાનો અણે કાઢા શરાફુનાં દી મેહેજર કરાપાના કારણાં
 શરાફ મેહેજર નાં અશી દાખલાં કે ઉપર શાલાલના અરનારાની જરૂરુની દિલ્લાના
 છે અને રાદ્યાં તે મેહેજરનાં પરો આરનારાયોનો નદેઝુનાં કાઢાયો છે એટાં
 ને શાહેશીરો છે પરી જાંદા ચુંલે ઉશ્રી અનુભાવનાં અને જાં ઇકરશી મેહેજરને શાહિ
 નીલાયમાં કાઢાયે પાછાને હું અધ્યતી અભસે જે અગ્રોલો સે દ્વારાશી લાખરી તે

ઓદાતાલા. કો. ભૂલેરી. જાનો. ભૂલંદ. અરતભાજું. *

શાહુબ તે. રેહેના. નામથી. આડ. મેહેરા. શાહું. અરુંથ. *

શ્રી. ઈરા. ન. શોહેરના. વતનીઓ. શ્રી. ભૂમખઠી. બંદરના. રેહેરા. શી. ઓ. *

ઓદોસ. દ્વપનો. ભૂલેરી. કુરામતના. આચંદો. લેપુખઘની. તમા. ઈજત

નીરાંજના. અનો. ભૂલંદ. અક્રાંજના. અનો. ઓડોસ. અરતભાના. અનો.

શુરામતના. શાહુબો. ઓદાતાલા. હનેશો. રાખો. તે. શાહુબોની. જીરજાતોને

કુયે. તે. શાહુબોને. અરજા. અનો. ઉલજેમાંશા. કરુંથાને. તરાદી. લઈને

લખના. રે. પેલા. શાહેરીના. કરના. રાખોને. આડા. નાણી. તંચી. નેના. પોને. ઓહીશઠી.
આપદા. શાહું. તેના. પોની. રાણીની. કીએ. તેના. પોના. નામશાએ. કે. અખીં છે. તે. જીર
શીમાંસો. શાહું. કંભા. કુ. ભાલું. પડે. બને. ઉ. હિંદા. રનો. લંદા. ધરીની. લખે. લિંગે. શીરુ
લને. પાશને. રણ. શાંધલા. ગુરારાનીના. ચાંદનાંને. શામળ. નહીં. પડે. પાશને. સેદલી
હિંદા. રનો. રચાલ. હિંદા. રસોથી. ભૂદીધાડી. દેખ. ડચા. શાહું. તેના. તરણુંમાં. ની. જીર
પાશ. રાહું. હરતે. () એહા. નાખીયાં. ભૂલેનાં. *

ઇને મેહેરખાંની ઝરમાં વીને જેકે કાચીશાં બાખતનું મેહેરખાં
 આં દિશાએ હાંનાં શોહેરનાં પાદશાહી શાલતનાં તુંની મકાનનાં રેહે
 નાં રાં ઘૂંઘેરગીનાં થાં અં જે ઝરાને લો તથા ઝાંબે લો તથા મોહો
 રાં દાંબે રાં મં દાંબું મી ડ્રોનો અન્ધે લો છે તે ઉંપરનાં નજર ઝરમાં
 વીને અને પોતાની ઘૂંઘેરગાં ને ગાહુથી તપાણી લે અશાલશા
 એ શારી રવે શાથી દુંશાત જે ઈને ઇને તે ઉંપરનાં રાં હેઠોની
 શાનાં અતા તથા પીછાનાં તથા તે શાખનાં ઝરનાં રાં (શાહેનો)
 નાં અતા તથા તે હેઠાની મોહોરો તપાણી જે ઈને ઉપાછાં શાફ્રા
 હુંપરનાં લખી ડાપખૂં અને પોતાનાં ઘૂંઘેરગાં નાં માં તપાણાં
 શાતખતથી અધિક ઝરનાં જુનતદાર કરખૂં — તારીખ
 ૨૧ અનુભાવી જમાદી કોલશાંની શાને (૧૯૪૯) હૃતી*

(૧૧૭)

(શાખાશી. (૧) રેહેલી.)

અન્નેથું મેહેજર્ડ. નો. ધર્મા. માહેર. ડ્રિલો. તાં એલ. નાન્દુમિશ્રો.
 મીર. મહુમદ. શાહેજા. તથા. મિરજા. ડ્રિશા. અલાહ. દિરેક્ટર્સની
 નથા. તમાંમ. ક્રોનેલો. તથા. પુલેરો. શાહેરો. આ. દિશા. ક્રેનું
 નલાં. અલીને. ભોગલીંચે. તે. શાહેલો. ભોગીશી. મહુને. માલું
 ગઢે. ડ્રિલો. માહુરા. વેદિયા. મો. આનીછે. ડ્રિને. ઇ. એ. તેવાર્ડના
 શાહેજા. પુલરો. શ્રી. દાગરો. ના. દશતાત. માહુરા. વી. કો. કો.
 ડાનો. ડાનેડાયા. લેમાં. કર્ચ. શાક. નથી. ડ્રિનો. ડ્રિલી. ના. ના.
 અ. અશાલ. પુલબંદી*. અખતંગ. હાજુઓ. મા. કંપનીન. મ
 હનદ. હાશંભ. (દિશા. હદત. પુલંદ. મરતાયાનો. પ્રક. ડ્રિલદ)
 અનો. માફીની. પુલણ. નો. કિલંમની. જરૂ. તથા. ડાહુલ. પાખડા
 કે. જરે. કરનાર. તથા. ડ્રિલાધી. નથા. લાલી. દિલંમનો. દિક્કો

કરનારા. તથા. કુલેલ. ઓછોમાં. ઓહોયો. કુલેલ. અને. દાનાં
 વોનો. દાનાં. વ. ઓહોયો. ડાલેભ. કુલ. હાજીઓ. તથા. કુંજરગ.
 લોઓમાં. ખરો. જેક. હાજી. મહમ્ર. હાશોમ. શાહેબ. આ. ઉશાકુહા
 ન. શેહેરની. દેપારીનીછે. કુદ્વાદા. કુરે. ઓ. દાતાસા. લેહેની. *
 મુજલગદો.)

(શાખશી-૩) ચીજી-

કુકીરને. માલુમ. તેલે. રઘુ. બેહેજર. આ. ઉશાકુહાનથી. આપે
 લૂછે. ને. માહુરી. પીળાણાલા. કો. ઉશાકુહાન. શોહેરના. લોકો
 ની. ઓહોયો. ક. કિંડરછે* લખનગ. ઓહોમહ. કુંશાતરી *

(ઉશાકુહાત. ખૂલદ. શાનનો. રઘુ. ખૂલદ. મહાનનો. દીજત.
 તથા. નેકબાબીની. નીશાનનો. કુંજરાઓમાં. તાજાખાખરખે
 ઓઓ. ઓમદો. આગા. મહમ્ર. શાહેબ. રોદાગર. કુંશાતરીની. છે*)

(શાખા. (૩) તરીકે)

ક્ષેત્ર. લખેલું. મેહેજર. જોહિપામો. ક્રાવીઓ. ક્રે. હેની. ડિસેલ.
 તથા. હુકીકતના. લખના. ચાંદોભા. કાંઈ. શોબેદ. જથી. ડિસે. પું
 લંદ. લના. બલા. ડિસે. પ્રાઇ. ડિસેલા. બલા. ડિસે. અની. મહામદ.
 શાહેશ. અગ્રે. મીરાના. ડિસે. અલા. કિશે. કુદુની. હિલોફું. શાખ
 શા. નન્દુમના. વિલમમા. ઘરાં. ક્રાવેલા. ડિસે. શી. ઈરાન. રોડ
 રમા. ઉલેફું. નન્દા. ક્રાંતા. નન્દુમના. વિલમમો. ક્રોઈ. એનો. ક્રોને
 લ. માદુરી. નન્દરમો. ડિસે. વતો. નથી. અગ્રે. જો. શાખશો. એ. એ. એ.
 નરમદા. ક્રા. કુદુ. લખી. તે. શી. વિશે. કુદુના. શોહેરના. લો. શોભા
 ધરા. પુંલી. ક્રા. ડિસે. મોહોરા. શો. વાગ્યા. છે. ડિસે. તે. લો. ક્રો. ના. એ
 શે. લખત. તથા. તે. લો. ક્રો. ની. મો. હો. રો. મહને. માલ્દુ. માછે * લખ
 તંગ. શાઈ. ક્રા. લો. ક્રો. ભા. કુમતરીલ. ડિસે. કુદુ. કુદુ. લ. તો. પણ

તોબાઈ * (ઉંશાહુદત મોહેરા મરતખાનો રૂપને ઘૂર્ણદમ
કરનનો ઈજાત તથા લેખ અભ્યાસીની વીશાંનલો પુંજોરો -
શીઠિએ હો રાને પાછ લોકોમાં રમી અછો રૂપાંગાંડા ઈએ ૬-
રૂપદૂષ રસ્ફુલ શાહેબ શોરોરોર દિશાકૃહાંની છે *

(શાખશી. (૪) મોષી)

ઉંલખેલાં મેહેજરરોની મરતખાના લે દિશામો રૂપાંડા એ-
મેહેજર આં દિશાકૃહાંન શોરોરાંની મે લો રંધું છે હેનાં અ
શાલ શાહીના કરના રાખોને તથા લેનેની હક્કીકતને ગે અં
શીલીછે કે દિ મેહેજર દિશાકૃહાંન શોરોરના પુંજોરોરાં નાનું
મીચ્યોન્નું નરોકુલેલ્લું છે રૂપને માહારો બાધને હાણ શાઈએ
મેહેરી બાળર મુરગી રાને માહારો કાઢો રૂપું અનીર અ
રૂમદ બાધર જાણર મુરગી દિ બોટું જાળા ધોરી દિ મેહે

(૧૨૧)

જીરં ઉંપુરાં મોડોરાં તથા દશાતખતાં કૃપને હું સેહેનાંને પ્રીતાં
 હું છેણું. કૃપને હિ. શાહુદ્દાલ બખતી બખત સે. જગતો. ઉંપુર હું.
 પોતે હાલેર હતો. લખતંગ હાળ તથા શાહીને હોમાં પુંઅતરી
 ન. શાહીએ અભૂલ. રસ્મૂલ. ઉખને હાળ. શાહીએ હ. મે ફેદી.
 બાલર ઝૂરુઠી * (હિ. શાહુદ્દાલ મોડોરાં મરતખાનો. કૃપને
 વ્યાલદ. મકાનનો. ઈજાત. તથા. નોષભખતીની. ની શાં નની. ઘૂ
 લેરાં. શાહીએ હ. લોકો મર. કુંમણો. હાળ લોકો માં. ધર્માને ક
 હાળ. શાહી એ અભૂલ. રસ્મૂલ. શાહેબ. વેપારી. એશાહુદ્દા
 નીની(છે.))

(શાખશી. (૫) નાંચમા.)

હિ. મેહેજાર. હું. પોતે. ઈરાનથી. લંઈ. કૃપાચેચ્છી. કૃપને. હિ. મેહેજ
 ર. ઉંપુર. જો. શાખ શો. હિ. શાહુદ્દાલ. બખતીછે. જેહુનાંના. બખેચ્છા.

મોંકાંદીંતર્ણાં પુનરભી રૂપને ઉંશાહીનાં લખનારૂ શાહેબો-
બેશાફું ઉશાકૃદુંનાં શોહેરનારે હેવાશી છે. રૂપને સેહેનાનારું લ
ખેઅભાનું કાંદીંતર્ણાં પતાં ભથી લખતંગ શાહીએ દાંલોઝોનાં-
કંભતશીનાં મોહમ્મદ હુશાન ઉશાકૃદુંની. (ઉંશાહુદત વ્યૂહ
દાંલાનો અને વ્યૂહદાંલાનો મજાંનાનો ટીજાં તથા નેકબિલ
તીની નીચાંનાનો વ્યૂહદેશગાં શાહીએ દાંલોઝોનાં ઉંશ્શો જ્ઞાગા
શાહીએ દાંલાનારું શાહેબ શોહારું ઉશાકૃદુંનીનો છે.)

(શાખ શરી. (૧) છઠી.)

ઉંતમાન ઉપર લખેલી ઉશાલેશાહુદત તથા મોહુરો રાહીનાં
બેશાફ તે કુંભમધરીનાં હુણું મોહમ્મદ શાલેહે આનાં વ્યૂહ
શાનદી * (ઉંશાહુદત મોહુરો અદ્દતભાનો રૂપને વ્યૂહદ
દાંલાનનો હુશામત અને ઉફબાલનો રાહેબ વ્યૂહદેર

(૧૨૩)

૧૯૩૫કાબ્દ - લોકોમાં ઉત્તરાંગાંભાનાં અહિની શાહેબ
શાહેબ - વેપારી - અંશાત રીની છે *)

(શાખશી. (૭) ગી.)

ઉશાતેશાહુદ - અજસ્થુર - લમાંન - લખેલી - તથા - મોહોર - ક્રીધેલી
શાહીલે - તેમાં - કાઈ - શાક - રોષેદું નથી - લખતંગ - હું - કુમતવી
ન - અભૂલ - રહીમ - અરનાંડ - અહિની નખીયાંન - શીરાળનો
ઓફશે * (ઉશાહુદા - ઓદોથ - અરતાયાનો - વૃદ્ધાંન - અધાંન
નો - ઈજટ - તથા - નેઝબુખતીનો - શાહેબ - વૃદ્ધાંનોરગી - તથા - હિક
બાલનો - આંદા - મોહોર - અભાબ્દી - તથા - વૃદ્ધાંનોરગ - લોકો
ન - અભોમદો - અભૂલરહીમ - અરન - શાહેબ - વેપારી - રઠાંન
અની છે *)

(શાખશી. (૮) દાસની.)

કુઝીરને માલ્યામાં છે કે... અદિ મેહેજર... ઉશાદુદુનથી... આવેલું
છે... અને... માદુરા... પીછાએ લા... ખુલોરગ... શાહુયોની... મોહોરો
ઉ... મેહેજર... ઉપર છે *... લખતંગ... મહમદ... હાદી... તોભા... તોભા
ઈ * (ઉશાદુદુલ... મોહોર... મરતબાનો... રફલે... ખૂલાદ... મકાન
નનો... વીજત... તથા... નેકબખતીની... નીરાંનનો... મોહોર... ખુલોર
ગો... તથા... ખુલોરગ... શાહીઅદ... લોકોમા... મોમદો... આગા... કુ
ઈઅદ... મહમદ... હાદી... તોભા... તોભાઈની છે *)

(શાખ શ્રી-૧૮) મા.

ફુલીરને માલૂમ છે. અને દિવાત તે હેડી ક. ખરી છે જે. હ. મેહેજ
૨. આ વિશ્વકૃત હાથી. આવે રહ્યે છે. અને. હ. મેહેજ ૩. વ્યાપોરગ.
અધીકારાંતરથા. ફુલને લ. લોકોની. ઓહોશોભી. અનતદાર. પા
ઠકાય. (તે. હુ. સાંજુય) લખતંગ હું. કંગલશીળ. મીરલ.

(૧૨૭)

મહમદ·લાલ·અરોરા શાંતિની * (એશા હાદત· મોહેરા· મરત

ખાનો· ડ્ર્પને· ઘૂર્ણણ· મધ્યાનાંનો· હિજત· તથા· નેકબાતીનીનીની
શાંતની· મીરાના· મહમદ· લાલ· શાહેબની છે *)

(શાખા (૧૦) દશામી)

કૃષ્ણાને· બહુરથેને· ઉભે હેજરને· શ્રી· ઉદાહૃતાનથી· ચાપી

છેતે· મહને· ઉદ્ધીનછેષે· શાહી· અનો· દક્ષાતથે * લખનગર· શા

દીક્ષા· લોકોમાં· કુમતરીન· રૂપબદ્ધા· શામદ· રૂપલ· મુંશાવી *

(એશા હાદત· મોહેરા· મરતખાનો· તથા· ઘૂર્ણણ· મધ્યાનાનો·

હિજત· તથા· નેકબાતીની· નીશાંતનો· ઘૂર્ણેરગ· શાહીઅદે

નો· આનદાનનો· અનો· મોહેરા· પાઠ· લોકોમાં· ઓમદે· હાજ

લોકોમાં· ધર્માનો· નેક· હાજી· શાહીદ્યાદ· રૂપબદ્ધા· શામદ· દેખાવી·

શીરાણ *)

(૧૭૯)

(શાખશી.૧૧) આગ્રેન્ડારમી

અથ-મેહેજર-મજાસ્કુર-આફરા-એંક્ષામો-આપ્લિકેન્ચ-ક્રી-ટિશ
 ક્રુદાન-દોહેરાન-શોદાગારો-તથા-ઓભાન-તથા-ક્રુનેલ-નાન્દુમી
 લોકોની-મોહેર-ઉ-મેહેજર-ઉિર-છે-તેમો-કશી-શાકશો-બેદન
 અ-લખતંગ-કંભતરીન-બંદો-મોહસુદ-લાઝર-શીરાળુ* (૩).
 શાદી-દત-મોહીદ-મરતાનાનો-અને-ઘૂરદ-મજાનનો-ઈજાત-
 તથા-નેકાયાતીની-દીક્ષાનનો-આગા-મહમદ-લાઝર-શાહેબ.
 શોદાગાર-શીરાળુની છે *)

(શાખશી.૧૨) આરમી.)

ઉ-મેહેજર-મધે-નેકાય-મજાસ્કુનો-અને-ખીનાંદો-લખેલી છે-તે-
 શાહીછે-અને-શરવે-લાઝર-ક્રીધેલા-(શાહેબોના) નાંઓદી-
 દ્વારાતથે-તેમાં-કાર્ય-શાક-શોબેદુ-નથી- અને-ઉ-મેહેજરના-

(૧૨૭)

શહીનાં કરનાર તમાંમ શાહેઓને ફું-પીઠાણું છે ઉંલખતં
 ૨૧- ફુંભલસીનાં કૃશીર- અરનાંર મહમેદ- કાળંમ- મેહેમું દ-
 માંજે દરાંનીનો- છોકરો * (૩૫- રાહુદત- મૌછોડા- દરખનો-
 અને જૂલંદમદાનનો- ઈજત- તથા- નેફુલ્યભલીની- નીરાંન-
 નો- દ્વારા- મેહેમું દ- શાહેબ- વેપારી- માંજે દરાંનીની છે *)

(શાખશી. (૧૩) સેરાભી)

એ- મેહેજા- મધે- જે કાંઈ બીજાં લખેલી છે- તે શહીઠે- અને-
 તમાંમ- (શાહેઓ) ના- નાંમ લી- દુંદરતથે- તેમાં કાંઈ શાખ- શો-
 વેહ- નથી- અને- છ. (મેહેજરમાં) શહીનાં- કરનાર- શાહેઓ
 ને- ફું- પીઠાણું છે કિ* લખતંગ- ફું- શાઢીઝે- લોધોમા- કે- મ
 તરીન- મીરલા- કાળંમ- દિશાદ્રુવાની * (છ. રાહુદત- મૌછોડા-
 મરન ભાનો- જૂલંદ- મદાનનો- ઈજત- તથા- નેફુલ્યભલીની- ની

(૧૨૮)

શાંતનોં ભીરળાં મહામદ કાળાં શાહેબની છે *

(શાખશ્રી. ૧૪) ચઠિદામી *

કુલીરને માલ્યદિપ છેલે રાહિ મેહેજર આંદોલનાં એસાં કંબાં હોય
 છે. અને હિનેહેજર ઉપર લે. શાહેબોની ઓહોરો છે. તે હેણાને
 કુલાંદ્રૂષ છે. લઘુનોં હાજી લોકોમાં કંમતરીના મારણાં
 કુચક. (ઇંશાહાદત ઓહોય દરજનો. અને વ્યંગાં માટે
 નો હીજા તથા નેકવ્યાપ્તિની નીશાંતનો હાજી. ભીરળાં કુચ
 ક. શીરાળની છે *)

(શાખશ્રી. ૧૪) પ્રદીપી)

અને મેહેજર જાખે ખૂબ આદરાં લે ઉત્ત્રામો કરાદે છે. અને અશા
 હુદાંભેલાં નજૂદીથો ભીરમહામદ શાહેક. તથા. ભીરળાં
 માટેનાં અલાં તથા. આંદોલનાં હોદેરનાં વ્યંગો ૨૦૦૦.

તथा· ઓલમાં· લોકોનું· મોકલે સુંદે· અને· તે· શાહે· ઓની· મોરો

રોમાલ્યુમ· આઈ· જે· માહારા· પીછાનેલા· બૂજોરગ· શોદુગર

લોકોનો· દશાનાભત· હિ· એહેજરમાંછે· એશાયાંછે· અને· ડ્રાઇ·

(નાલ) વિશાળ· પરમાણૂંછે * લાભતંગ· કંભતરીન· મહ

મદ· કરીણીની· (હિ· શાહુદત· મોહીસામરતબાલો· અને· બૂધદ

માંલાની· ચીજત· તથા· લોકાભાખતીની· નીશાંનાંનો· વિદીગાં· મહ

મદ· રાહેય· શોદુગર· કરીણીનીછે *

(શાખકી· (૧૧) શોલમી)

મૃદીરને· ભાંસુંમછેને· એને· એહેજર· શી· દિશાદ્રુવાંનથી· ડ્રાવીંછે·

અને· માહારા· પીછાનેલા· દિશાદ્રુવાંન· શોહેરનાં· શાહે· ઓની· મો

શોરો· હિ· એહેજર· ઉપરાંછે· લાભતંગ· ઘણો· કંભતરીન· મહમદ·

રહીએ· દિશાદ્રુવાંની * (હિ· શાહુદત· મોહીસા· દરબાનો· અને·

ઘૂરણાનાનો ઈજલાલથાને કાબુલીની જીશાંનનો

દ્વારા મહમેન્ડુભાઈ વેપારી દિશાફાનાની નીચે *)

(શાખા(૧૭) શતરાખી)

દ્વારા મહમેન્ડુભાઈ લોઇલ - પ્રે. આ. દિશાફાનાની નીચે

માહારા ઓલાલ ઈતાં શોદાગઢો નથાં ઝૂંનેલ લોકી નથાં

ઓલમાંદો નથાં નાન્દુભીઓની ઓદોર રિએન્ડર કાર્યક્રમે

તેએશાફાને એશાફે હૈછે તેમાં કાંઈ એલાટું નથી *

લઘુલંગા પંચતરીનાં એદો ડ્વારા એ કરીયાનુ * (દિશાફાનાની નીચે)

દતાનો હોદા અરતાનાનો એને ઘૂરણાનાનો ઈજલાલથાનાનો

ને કાબુલીની જીશાંનનો ડ્વારા શાહેબ શોદાગઢ કરીયાનુ

નીચે *)

(શાખશ્રી·(૧૮) અંગારી)

એ. એ. હે. જર. નથેલી. લખેલો. બીજાંશી દશકું રાના શે. હે. રમા. ભા. હા. રા. આ
 પણી. જગદીશ. ભા. હા. રા. ક્રે. ઉદ્ઘા. મા. રા. વી. શ. એ. હ. એ. હે. જર. ઉ.
 પર. શ્રી. ઉદ્ધકું. રૂ. ના.
 અને. મો. હો. રા. તે. લખતંગ. શા. ઈ. અ. હ. લો. કો. સા. કુ. મન. લદી. ન. શ. ઈ. અ.
 એ. એ. હે. હી. એ. બને. ચા. કા. શ. ઈ. અ. હ. દશાન. શ. હા. ઈ. * (એ. રા. રા.
 રા. ઉ. ના. મો. હો. રા. ભરતભા. નો. અને. વ્ય. લે. એ. મણ. ન. નો. એ.
 જત. તથા. ને. અ. અ. તી. ની. રા. ના. નો. રા. ઈ. અ. હો. ના. આ. ન. દા. ન.
 નો. ચા. ગા. શ. ઈ. અ. હ. એ. હે. હી. ની. તે. *

(શાખશ્રી·(૧૯) અંગારી શા. ભ. ૧.)

એ. એ. હે. જર. ભા. હા. રા. ક્રે. ઉ. ચા. વી. શ. ધ. ધ. ધ. (ભી. ના.) નો. એ.
 એ. હે. જર. ભ. શ. ઈ. દે. શા. હે. પો. એ. લખે. લી. તે. નો. એ. એ. એ. એ.

કીંદ્રી. હેઠાને જમેડ્યો. ક્રમને તો શાહેબો ની ઓહોર. તથા. દસ્તા
 અતને એ. પીળાને અં. દિ. મેહેજર. શ્રી. દિશાકૃહુંનથી. આવેલુંછે.
 તેમાં કંઈ. કંઈ. એલાક્ર. નથી. લખતંગ. ઓ. સામે લાલાનો.
 બંદો. કંભતરીના. મહમદ. તકી. દિશાકૃહુંની. (દિશાહાદત. ઓ
 હોદા. મુદ્દતખાનો. ક્રમને. બુલંદ. માફાનનો. દિશાહાદત. નેકાલ
 અતીની. ની શરીન ની. ચા(ક). મહમદ. તકી. દિશાકૃહુંનીની છે.)

(શાખા(૧). (૨૦) વીશામી.)

કુષીરને. માલુમ. છે. કે. દિ. મેહેજર. શ્રી. દિશાકૃહુંન. શોહોરથી. આ
 વાઉં છે. અને. દિશાકૃહુંનનાં. બુલેરગ. શાહેબોની. ઓહોરો. દિ
 મેહેજર. ઉપરાંછે. લખતંગ. મહમદ. તકી. એહેબહાની. શાહી.
 (દિ. શાહાદત. ઉનચા. દરખાનો. દિશાહાદત. તથા. નેકાલ અતીની
 ની શરીનનો. આજા. મહમદ. તકી. એહેબહાનીની છે *)

(૧૩૩)

(શાખશી. (૨૧) બાળીશાખી.)

અ. મેહેજર. માહુરા. જંગોચામા. ડ્રોપીટી. પ્રે. શી. દિશાકૃષ્ણા

ન. રોહેરથી. મોકલેલુંછી * લખતંગ. ઓદાતાલાના. બંદા

વોમા. કંમતથીન. મેહેભૂદ. ઉખનો. દુલ્લ. મહુમદ. દિશાકૃષ્ણાની.

(અ. રાહાદત. ભૂલંદ. ભરતભાનો. હિલત. તથા. નેટ. વ્યખ્યાતી

ની. નીશાંનની. ડ્રોપા. મેહેભૂદ. શાહેબની છે *)

(શાખશી. (૨૨) બાળીશાખી.)

કૃકીરને. માલુમઘેઢે. અ. મેહેજર. ઓ. દિશાકૃષ્ણાન. શોહેરથીડ્રો

ભીટીછે. ડ્રો. માહુરા. પીઠા. નેલા. ભૂલોરગ. શાહેબની. અ.

હોર. રો. મેહેજર. ડ્રોપરથી. લખતંગ. મહુમદ. ઉખનો. દુલ્લ.

મહુમદ. હોશીન. ઓ. રાશાની. (દિશાકૃષ્ણ. ડ્રોપા. મરતભાનો

હિલતડ્રો. જેકખખતીની નીશાંનની. ડ્રોપા. મહુમદ. શા

(૭૩૪)

હિન્દુ ની છે *)

(કાન્ચણી . (૨૩) તેવી શામી .)

કૃષ્ણને માલુમ છે ને હંમેસેજર આ દિશાન્દે હાજિથી રયા વી ઉંચે .

અને આ દિશાન્દે હાજાન - શોહેર નાં મીઠો રાં ઘૂંઘે ૨૦૧૬૧૨ . રાં હુ

ઓની ઓદોરો . હંમેસેજર જીર છે * લખતંગ . અનુમદ-

હાંન . શીરાળ *

સુર્ય . આઈડિ . આ . હરાંન . દેશનાં . દલજિ .

હાલ . આ . મુખભર્દ . કેશનાં . રેહેવાસી

સ્પોર્ટું . આ . મુખભર્દમો . બલાધેલું . એસેજર .

مکالمه	علط	رد
حوم و حرام	حمر و حرام	۹ ۲۱
شین الادل	بشن الادل	۱۳ ۲۵
روز نقصان	روز نقصان	۱ ۲۶
زان	ازان	۳ ۲۷
وضع دیگر	وضع دیگر	۱۰ ۲۸
اسکندر بزرگ ۱۱۹۵ سکندر بزرگ ۱۱۹۵	اسکندر بزرگ ۱۱۹۵	۹ ۲۹
موس زوج دار شد و کسر بخواست	موس زوج دار شد و کسر بخواست	۵ ۳۰
منفرض کرد بد و بود	منفرض کرد بد و بود	۷ ۳۱
ذکر نمود	ذکر نمود	۳ ۳۲
از عمارت نظر بر	از عمارت نظر بر	۱ ۳۳
سن	سن	۰ ۳۴
خواهم بود قدر	خواهم بود قدر	۹ ۳۵
حقیقی نداند که امیدار مجمع شدند در شخنه صدر و جو هست چون اس مراثن داشتند و نظر موافق احمد لامعا صورت می خورد نظر نظر نشستند		

بر صحیر معلوم شد که این فخر از اصحابان رسیده است و مرادی جمعی از علما و اجلاء از

السلطنه اصحابان را آن میباشد کاتب

احمد فضله محمد حسن شیراز

می

نق و سخن لیان فیسبع مکان عزت و سعادت نشان سلائیل السادات آقا سید محمد
حضرت قوهه تن را در اصفهان در نزد والد خود ملاحظه شده خط و حرف مخفیان و اعلم

اصفهان پیاشد صحیح اقل السادات آقا سید محمد بن آقا سید حسن صاحب

نق و سخن لیان فیسبع مکان عزت و سعادت نشان آقا محمد تقی اصفهانی

حضرتی سلطان سید و بیاری که در آن محضر فوشه تو بند نیز کی داشتم و خط و حرف ایشان را
شاختم محضر اصفهان سیده است و خلاف نزار و اقل عجا و محمد تقی اصفهانی

نق و سخن لیان عزت و سعادت نشان آقا محمد تقی تهمانی بر خیر معلوم است که این

محضر اصفهان سیده و مراسی همچوی از محل اصفهان را پیاشد صحیح محمد تقی به

نق و سخن لیان عزت و سعادت نشان آقا محمد و حساب

حضرتی سلطان سید از اصفهان فرستاده اند اقل عجا و عمود ابن حاجی محمد اصفهانی

نق و سخن لیان عزت و سعادت نشان آقا محمد حساب بر خیر معلوم

که این محضر اصفهان سید و حرف همچوی از اغره و معروقین را پیاشد صحیح هدایت حجت

نَعْلَمُ سَخْطَ لِيَانِ فَسِيعَ مَكَانِ غَرَّتْ وَسَعادَتْ نَشَانَ آفَاقِ حَاصِبَةِ قَرْدَنِي

مَلاَحِظَهُ خَضْرَمَ خَوْمَ كَرْدَيْدَ صَادَارْ مَجْمِعِينَ كَلْمِينَ هَرَدَ فَضِينَ بَرَجَرَ مَحْمَدَ صَادَقَ وَمَيرَ رَاسَهَ اَسَدَ اَسَدَ

اَصْهَانِي وَسَائِرَهُ خَصْلَادَهُ اَهَالِي اَصْهَانَ وَاهْمَارَ اَشَيَانَ حَلَوْمَ كَرْدَيْدَهُ وَ

دَسْخَلَهُ جَمِيعَهُ اَهَاطِمَ تَجَارَ مَعْرُوفَهُ وَدَبُونَ تَلْكِيَهُ اَسْتَكَهُ كَرْسَهُ دَمَطَابَتِي اَصَلَّهُ

اَقْلَعُ الْعَبْدُ مُحَمَّدٌ قَرْدَنِي

نَعْلَمُ سَخْطَ لِيَانِ فَسِيعَ مَكَانِ غَرَّتْ وَسَعادَتْ نَشَانَ آفَاقِ حَاصِبَةِ عَرَاضِيَهُ

بَرَجَرَ عَلَوْمَ اَسْكَهُ اَيْنَ مُعْنَسَهُ اَزَ

اَصْهَانَ رَسِيدَهُ وَمَراَهِي تَكِيَهُ اَرْمَرَدَهُ فَضِينَ اَصْهَانَ بَرَآنَ عَلَآشَهُ رَالَّاَهَرَ مَحْمَدَ حَسِيمَ اَسْيَاهُ

نَعْلَمُ سَخْطَ لِيَانِ فَسِيعَ مَكَانِ غَرَّتْ وَسَعادَتْ نَشَانَ آفَاقِ حَاصِبَهُ شَرِيفِي

حَسِيرَهُ كَوْرَ مَلاَحِظَهُ شَدَهُ بَجْمِينَ وَهَلَادَهُ وَفَضْلَادَهُ تَجَارَ مَعْرُوفَهُ دَارَ اَسْلَطَهُ اَصْهَانَ عَيْلَهُ

بَلَاشَكَهُ شَمَهُهُ خَلَافَهُ دَارَ دَحْرَهُ الْجَلَلَهُ شَرِيزَهُ

نقش و سخن عالیان فیسبع مکان عزت و سعادت آقا محمد حبیر صاحب تاجر شیرازی
محضر کور ملاحظه شده و درینین علما و مصلحاء و تجار معروفین دارالسلطنه اصفهان

پاشد بلاشک شبہ و خلاف دارد و حرره العبد الاخر محمد حبیر شیرازی

نقش و سخن عالیان فیسبع مکان عزت و سعادت نشان آقا محمد حبیر عرب زندی
مضایین مرقومه تن و اسمای مذکوره تمام صحیح و شبہ درآن نیست و تمامی
از جمله معروفین میباشد و اما الاقل الاحترابن مرحوم محمد کاظم محمد دار زندی

نقش و سخن عالیان فیسبع مکان عزت و سعادت نشان میرزا محمد کاظم صاحب

مضایین مرقومه تن و اسمای مذکوره تمام صحیح و شبہ درآن نیست و تمامی

از جمله معروفین میباشد و اما الاقل السادات میرزا کاظم اصفهانی

نقش و سخن عالیان فیسبع مکان عزت و سعادت نشان حاجی میرزا کوچک شیرازی

بحقیر معلوم است که این محضر از اصحاب آن سیده و مواهر حرمی معروفین بران پاشه
الاقل لعلی کوچک

استشهاد ذکور کجا هم مسطور و مهور صحیح و شکایع شبهه ندارد و اما الاقل عبد الرحیم بن

روحوم محمد بنی حان شیرازی

نقل و سخن لثیان فیضیح مكان عزت و سعادت نشان محمده الا خاطم الاعیان سلاطیه السادات
الخطام آقا سید محمدزاده می صاحب طباطبائی برهیز علوم است که این مختصر
از اصفهان مو اهر جمعی از اعره مسروق فیضین بران می ساخته محمدزاده می طباطبائی

نقل و سخن لثیان فیضیح مكان عزت و سعادت نشان میرزا محمد حان صبا

برهیز علوم و تحقیق است که این مختصر از اصفهان آقا سیده ولیمهار شریف جمعی

فضلاد صلوات عزیز است اما الاقل میرزا محمد حافظ

نقل و سخن لثیان فیضیح مكان عزت و سعادت نشان سلاطیه السادات الخطام

النجا، الکرام خیر حاج حاجی سید عبد الصمد برجیر شیرازی برهیز ظاهر کردید

که مختصره از اصفهان امده تھیں است که صحیح است اقل السادات عبد العظیم

سید عبد الرسول بن حاجی سید جهادی بازار مرنسیع

اعلیٰ سخن خان پیغمبر مکان غریت سعادت اثیان سلاطیه السادات العظام فا

سید حسن صاحب تاج هر اصفهانی نخست رایج براز ایران آوردم و اشخاص کمک نموده

امد در نوشت اثیان جرفی نمیباشد و از اهل اصفهان اشخاص کمک نوشته بلاشك

پیاشد و مرغی در نوشت اثیان نمیباشد صحیح اقل السادات محمد حسن الاصلح

اعلیٰ سخن عالیجا و پیغمبر حاجی کاهن ثبت اقبال همراه عمدة الاعاظم والاعیان زبدة الاکابر

والارکان حاجی محمد صالح خان صاحب تاج هر شورشی استشهاد مزبور

کما هم مسطور و مکور صحیح مبارکب و انا الاقل حاجی محمد صالح خان شورشی

اعلیٰ سخن عالیجا و پیغمبر حاجی کاهن غریت سعادت همراه حلالت اقبال کتبه

عمدة الاعاظم والاعیان زبدة الاکابر والارکان عبد الرحیم خان صاحب تاج هر شورشی

تعلیم و تखطیل شان پسیع مکان غرت و سعادت نشان سایر اسلام داشت این نظام و خوده آنچه از
النظام آنها سید عبد الرسول صاحب تأثیر ایجاد کرد و بدین شیوه در احوال
و حقیقت آن نمیباشد و غالباً این تفسیس اقایان آن فاتحی محمد صادق و میرزا اسد اللہ ایضاً
از جمل مشاهیر و معارف میخواستند و در این اصل ازین دو نفر در علم بخوبی سلطنت نمیباشد
و اشخاصی که در حضرت شاهزادت نوشتند ادارا اعظم اهل اصهان و تجارت مشاهیر و پاشرند
و دستخط او شان و عدا و شان مسلم است صحیح اقل اسلام داشت عبد الرسول طبایل

تعلیم و تখطیل شان پسیع مکان غرت و سعادت نشان سایر اسلام داشت این نظام خوب است
سید عبد الرسول صاحب تأثیر ایضاً خضرموده من ملاحظه کرد و اید و این جانب نزد
اصهان ملاحظه کرد و این دلیل مصالحت و حقیقت این دام صادر از شخصی مشاهیر و اعیان میباشد
پاشرند و خط خود را دخود حاجی سید محمد میرزا مزار مرغی و خاله خود حاجی سید محمد باقر مزار مرغی
برده است این شناسم و درین شهادت نوشت تراجم خود و دم اهل الحراج و السادات

خطوط و اشعار ایشان بین مخنوشیه و باسای دخلوط شرکت خود فرین سازند تباریج نسبت و

یکم شهر جادی الثاني

۱۲۴۶

نقش و سلطنه یکاب قدیمی العاب قدیمی یا ب جامع الفروع و الاصول طاوه می التعلو و المعمول
 افضل احصلا و اعلم العلما و خیر الحاج و المقربین طاوحی محمد هاشم صاحب تاج راصحانی زید فضلہ طاطه
 خضر و قم کرد پدیده دار زینه کن طبعین پسرین رسیده محمد صادقی و میرزا اسد آباد و سایر احصلا و اعلم
 و امالي اصفهان و اعمار ایشان معلوم و مشخص و سلطنه جمعی از اعاظم تخارذه می الاعتبار معرفت
 و بدون شکی است و سوا د مطابق اصل است اقل احتجاج محمد هاشم

نقش و سلطنه یکان پیش مکان غست و سعادت نشان عده الاعاظم و الاعيان زیده الائمه بروه الار
 کان آقا محمد صاحب تاج روشتری بر حفیه معلوم است که این نخنفر از اصفهان رسیده
 و معاشر حبی رمزو قبی اصفهان را آن بیباشد تخدوشتر بی

فارسی خود شیوه‌جی باکنست جی صراف فارسی در اینجی نه تن جی صراف فارسی کنخیر سداب جی باست
منی داده بنا فی هر بان جی موکانا فارسی هر مزدجی بیکنی بل فارسی نخیز جای ایل جی باست

۱۹۰

ساده خضری کل عیان فسیح مکان غرست سعادت شان عده الاعاظم دالاعیان المزیدیت
خود شیوه‌جی باکنست جی صراف در باب اثبات اصالت حیله است شهادت مرقوم درینجا
سمور کنی سبب است تمام رسایده

بسم الله تعالى شأنه العزيز

مستدعی پنهان از آنان فسیح مکان غرست سعادت شان کار اعاظم دام فاخر
الکرماء الاعاظم والاحیار بکار ذوقی المزدیت بار ایرانی حاضرین بند رسنی داشت
بر کار تم کلمه اصیح کشیده و در حیث فرموده خضری کرسپ که من چون داده اعاظم و فضل کار افکار
و اعیان و اکار مدار اساطیر اصممان نخیز گزیر در آورده باساده اول ملاحظه فرموده باشد
شرایطی خود درآورده و مطابقت سوا در این اصل معنی اصل معروف نیست شود

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

کفیت تاریخ فارسیان و کتبه ایشان بخوبی نیاشد که عالیجا بان خدمتی افتابان الیه
 الاعز اباکرم آمامیر محمد صادق و الفاضل الحاصل الحاصل میرزا اسدالله که درین جهود احمدی درین
 من محل از ایشان نه پاشد مرقوم فرموده اند و محل تردید و شک که نیاشد و ام العبد عالی
 محمد ابراهیم بن حاجی محمد علی الاصفهانی

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

سبانخواه بش اعیار و اطله دعله داعر طایفه فارسیان مفصله سمت امام پدرفت
 ادبار و جی هر فرجی بهمن جی سمت ادبار و نو شیروان جی نور و درجی سمت
 ادبار و میثین جی نور و درجی سمت ادبار و سه اسب جی شاپور جی سمت
 داریا جی بهمن جی سمه مرجی فارسی جشید جی محیی بهمنی داریا جی جهانی
 بهمنی نو شیروان جی داریا جی نور و درجی نو شیروان جی داریا جی خورشید جی سمع

اچه درين مرقوم است عاليجناب مقدس القابن فضائل و معارف اگر باز
سلام السادات و الحجاجي اما مير محمد صادق و ميرزا اسدالله كه مارسین درين
فن یباشند و تحسين رسانیده اند و مرقوم کرد ديده و خلافي ندارد العبد انعامي عجا

ابن مرhom حاجي محمد ابراهيم

اچه درين صفحه مرقوم است قول ما هرین در فن بحوم در رياضي است العبد الاقل حاجي بهلني

ابن المرhom حاجي محمد ابي الشهير باخونه

رسانده عالي

اچه درين صفحه مرقوم است مفضل است كه عاليجناب همسي العابن جيدي
الرمان سلاط السادات آن و الا حسين بابن اما مير محمد صادق و ميرزا اسدالله
علمی خرموده اند و از امل فن یباشند و همارست تمام درين فن دارند و مشهور است

من الاقل محظوظ

ساجی محمد علی

مودودی و مساواه

در این که در باب تاریخ خارسیان مرقوم و محرر کرد دیده خلاصی ندارد اما اصل اسکن محمد حسین باز

و

تحقیق کسپه و حدیث آن تاریخ نجف است که مصلحت امشرد خارق مرقوم کرد دیده خلاصی ندارد
و اما العبد اللاتم الحاطی محمد حبادا بن المرعوم اسکن محمد علی عین حبادا بن محمد علی

و

در باب تاریخ درس و حکومتی امر کسپه الحاضر مرقوم کرد دیده خلاصی ندارد و احتمال شبهه
در آن نسبت العبد الحاطی محمد حسین بن المرعوم حاجی محمد علی

بر العالم

حالیها من قدسی الطایان و حسید الزمان سلال الاطیاب و الاعیان امامیر محمد صادق
و میرزا اسدالله خارسین در این فتن عبا شنید ائمه محمد علی محمد حسین

کنیت مردم در باب تاریخ فارسی و چکوکی امکنی پرسیده بجای کارش با اینه اصلاح و قطعاً محل
شهبه منیت و در مهارت و فضیلت عالیجاً بان حمایت و کمالاً انساً بان زیده السادات
والاعاظم و خلاصه الاماء و الاحسن آقا میر محمد صادق و میرزا اسدالله سلمان اند
تمالی در علم نجوم و ریاضتی ججه و لائیان درین باب شکی منیت عرب ابوطالب بن محمد

سبم الله حیر الاساء

تعالی تاریخ فارسیان و کنیت کپره ایشان بجای عالیجاً بان قدسی القا بان حمایت
و دعایق انساً بان السید الاعلی‌الاکرم میر محمد صادق و الفاضل الكامل المأبد میرزا اسد
زیدی خصلها که هر یکی در فن نجوم بی عدیل و نظریه بیان فرموده اند محل رسیده شهبه منیت

سبمه تبارکه تعالی

آنچه درین صفحه مقرر و ثابت است در تاریخ ذمسن چکوکی امکنی آن و وحدت تاریخ ذکر و
بجایه فضلاً و محققین و محسنه و فن بیان فرموده اند خلاصی ندارد اقل احاجی محمد رادی بن

هـ والحمد لله تعالى

درست مطهور و خوکیک بخارش شیخ مظلقا و اصلاح نظر شک دشنه غشت و پیچیده من البو
خلافی در آن پناشد العبد الخاطلی محمد ابراهیم الرعوم حاجی محمد حسین بن حاجی برع

هـ العزیز

پوکی نارنج ذهن و کنیت ام که پسر خوکیک در قم کرد و خلافی ندارد و احتمال شبهه در آن
مشیت ابن رعوم حاجی محمد کاظم خود علی

هـ والحمد لله والاسواه

الخچه راعی جانب مفسر الغاب خصائیل و مکالات انساب سلاطه افغانم السادات
و بظیموس الرمان آقا میر محمد صادق و جانب خانقی و معارف انسباء خصائیل و مکالات
دستگاه زربده الافا خرم الامام جد و حسید الدوران میرزا اسدالله سلمها اللہ تعالیٰ
در درست بخوبم دریاضی باین نسبه امینه چاکه درین عبایان فرموده ام و محجی است مین
و لمسیت صحیح و احتمال خلافی در آن نسبت اقل احتجاج محمد ابن حاجی عسید الجید

نهاصیل تاریخ درس قدیر خویست که عالیجنوب مقدس الطاپ فضایل باب سلاطه
 السادات والاشراف و حید الدوران میر محمد صادق مجهم و جبار فضایل و قول
 مآب عمه الامام جواد علامه الفضل میرزا اسد مجهم زید فضایلها بیان نشوده اند
 و در همارت ایشان در فن بحوم در ریاضی شکی عیشیت اقلیم الحجاج محمد حسین بن الجرمون

الحجاج محمد رضا

عالیجناب سلاط السادات والاشراف میر محمد صادق و میرزا اسد الله ماہر در
 فن بحوم و سلط در این علم و انجپه در این صفحه تلی شده قول و رای ایشان پیاشد خلافی
 ندارد حرفه الاقلیم المروح حاجی حسین

عالیجناب مقدس الطاپ فضایل و خواصیل باب سلاط السادات الاطیاب
 اقا میر محمد صادق و میرزا اسد الله ماہر در فن بحوم در ریاضیه و انجپه در این صفحه مرقوم
 است قول ایشان و خلافی ندارد اقلیم الحجاج محمد عبیر ابن حاجی محمد حسین

مجسمه نهاد ذکر دو اعلم عند الله وحضره العبد السباعی محمد اسماعیل بن محمد حسین الطباطبائی المتقدمة

به المختصر

به انتهی

کفایت او کمیه در تاریخ فرسن عدم تعدد تاریخ مذکور بخوبی میخوین دارالسلطنه اصحابه
حرثه الله عن طوارق الحادیان بن سعد مودودی اندھلائی مدار و اقل الطلب عبید الله قرشی

به قدم عالی

او کمپه فرسن چونکی تاریخ فرسان مری است بغاۃ معرفت و دلیل دادری اشک

پیشہ میست حرثه العبد محمد علی

کلامت روایت السلطنه اصحابه

سو

اچه درین صنوم روم است اویال با همین در فن بحوم و ریاضی است العبد اصلالا
داست و التجار حاجی میر محمد باشتہ بازار مرغی عنین محمد باقر ابن محمد حسین الحسینی

در آن کوه غاری که مشهور ذیامین انسان گنجانی بکه خیر و است و بعضی از خوارق عادت
 و امور حجج برای زانجی اطهور میرسد و مذکور میشود که بعضی از طویعی محوس برای است انسان گنجانی
 و در کتاب حکمه اشراق نیز اشاره به قوامات باطنیه که خیر و خلاست خواهد داشت
 او شده است و ماضی حقیقت علامه شیرازی در شرح همان کتاب میرمامد الملک
 الطاف و کنخیر المبارک اقام التفسیر والعبودیہ فاما و اب القس و نظر معه و نجاح
 نفسہ ای العالم الاعلی حکم الله و احتجاج ای اراحته ایشی کلامه و از عبار است منقول و گفته
 و صاف نیز طا ہر میشود که سبای جمع امور غار سیان از معاملات و عبادات
 و خیر و همین تاریخ نبوده است و ازین تحقیقات ظا ہر شد که منکر کمپیه و قابل تبعید
 تاریخ نه از علم نجوم خبری دارد و نه از دین و آئین و طریقه محوسیه و غار سیان پس که
 متین بدین محوسیه باشد و درین طریق ایشان ثابت قدم و راسخ باشد لاحظه که پس از بر و میتو
 خط نشسته و مینیم بر و میتو مذکور باید نباشد و در طریق اسلام افتاده قدر ایشان عبادت
 مقرر و در آن مشهور و ایام را مرعی بدارد و الا از طریق ایشان خواج خواهد نبود و دعوای

فی کتابه المتنی بحکمہ الاشراق بهذه العبارة و حکماه الفرس بلکم تتفقون على ان لخل
 من الاخلاق والکواکب والسبابط العصریه و مركباتها را في حالم المزحی آنما چنان
 صاحب حسن من الملکوت و سوہ خرد و ما بالأشجار سوہ مرداد ما للناس سوہ اوی
 بیشت دهی الاوزالی اشاره ایا اینا و غلیس فشا خور سوی هر سوی افلاطون خیر چشم
 من کیا را ایکماد المیعنی مشی کلامه و ظایه بر است که عوام و غیر حکمکارا اور اکابرین معاونی غیر
 مقدور نماییور است و اینها کون طریقی سوی شهور فیاضین سلاطین درس نمودید و موضع تکمیل
 تاریخ سلاطین با تاریخ علماء و زبان داشیان است چراکه سلاطین بجز سوی طریقی فارسیان
 از عبارت حکای ایشانند و سلطنت ایشان نهیں سلطنت ظاہری بوده است بلکه در درست
 زه و عجادست و اور اکات باطینیه بیکمال بوده اند پاک شده ازان از تاریخ بحیم که در اینجا
 سلاطین عجم آلمینه شده است متعدد مسیر کرد بلکه بعضی از سلسله محسوس ایشان را اینها
 و محال الماء است الی میدانند حتى انکی بحقی ایشان کنخیه و راهپوری و غایب میدانند
 و کوئید که در آخر از زمان طور خواهد کرد و در عراق محالی است مسمی مکراز و در اینجا کوئی است

و سو این میں کب تاریخ مارکنجی دکلرا زا شان نقل نشده است و قول بعد میست که از راه
 چال است و اعماض از حق و اخراج ف از جاده صواب و از پکونی وضع این تاریخ که صد
 این طریق میست که از علاوه حکای طبائی مذکوره چهار کم جمع کسوز یعنی اربع زایده از دو راه
 شمس در دست صد و سی سال برج مسطور و عدم اسقاط آن دال بر زرای خان
 تدقیق و شدت محافظت بضبط اوقات است و بجا غیر حکای و علماء را توہاد دراک
 این تدقیقات و شدت اعتراف بضبط این حرکات حاصل است ازین اضطر
 لستیه شهر دایم فرس است با اسمی مهر و فهر چهار که این اسمی با خود از اسماء مکا
 است که ای از راحکا، عقول فردی و مثل افلاطونیه و ارباب انواعی نامند و در حق
 ارشان خلافی است ما بین حکای و حکای دوسره عالیکار الیوان مصدر در حق ای ای
 و ای
 خود را بیکی از آنها داشته جمادی با اسم مکن منوب با آن روز در هر روز چهاری
 و برقرار داشته باشد قال العارف الربانی و الحکیم الائمه الشیخ شهاب الدین سهروردی

دانحال سوم عاد است و عباد است ایشان طریق کسب و خطب شور و اعوام ایشان که بنای
 امر عبا داست ایشان را آن بود از سیان برفت خانچه در کتاب نیز مفروک ارزیست
 تدبیر است اشاره بهمین معنی شده است و هنده عبارت شارکسپر فارسیان به صد و پیش
 سال از قدم ماسی بوده است و اکنون عاد است برفت چون دولت ایشان درگذشت
 اشی کلامه و ایضا در تاریخ و صاف که مقبره را این تواریخ است در مصغی که تو اینجنته
 دلمه فیاضین الاسم ذکر نیاید فرموده است ایا طائفه فرس معاملات و عباد است لیکن
 برسین بعد از شهور اشی عشری ماسی رسی روز و سالی سیصد و هشت منی باشد و خوب
 علی الافراد در آخر ایشان یا آخر اسناد از دو افسوس ایشی و خمسه متر قدر خواسته است اعتبار گذاشته
 نباشد کرد و در هر صد و پیش سال بجا که کسب نمایند اشی کلامه و ایا قول بعد و تاریخ
 فرس و معابریه ماریخ سلاطین حجوس ماریخ علاوه بر ایشان نیز قولی است بیان
 سخیفه بی وحجه ایشان امثال این امور منیست مکراز جدید از سلف و ذکر علمای
 ارباب تقاضه ایشان حال اکنون احمدی از علاوه اسی و رسی از تقدیم در پیچ موضع ذکر نیست

السيد الله میر محمد صادق و میرزا اسد الدین کمال حاشرت ایشان در راست بحث در تاریخ
شک و مشهده میست و کتب العبد محمد رضا الحسینی الحسینی

الحمد لله و سلام على عباده الذين الصدق و العهد فتحی ناصردکه حاکمی تاریخ در گفت و
در کرسی سنجیکه بفضل دین تصریف شکارش از جمله مسائل معرفه و مطالعه و افحه است
و منکر آن نمی شود مگر کسی که اصول ادبی در علم بحث و ریاضی نداشته باشد چنان همچو
و در جمیع کتب این قن است بلکه تاریخ ذکور را شهرو اعرف ارجیح تو ارجیح متداول بوده
است نظر تقدیم وضع آن بر جمیع تو ارجیح و بهتر مطلعها تاریخ در بیان ایام از رای صحت داشته
و اعوام وضع نشده بود که جمیع از اوضاع مودود در قریب چهار هزار سال که امتداد
دولت و سلطنت پارسیان است موافق آن عمل نشده است و عالمین باز پیر ہدایت
اعیان و معارف و حکایات اسلامیین بوده اند و بعد از رمان برد خرد این شهر یار که
آخرین ملک ایشان بود و نظر اتفاقاً غرض دولت و اضطراب ملک و سلطنت ایشان